

32nd

કૃષ્ણ માનસંગુજ બારદ ક્રમાંકું ફોટો-સંચાલિત

૪૫° ૩૨' મ.

અંક ૭ મેં

સ. ૨૦૪૬

સન ૧૯૬૩

એપ્રિલ

માનસ

તંત્રી-મંડળ :

ડૉ. કૃ. કા. શાહસી

ડૉ. ના. કૃ. ભટ્ટી

ડૉ. સૌ. ભાવતીબહુન

શેલત

[છુટખાસ-પુરાતત્ત્વનું એક માત્ર ગુજરાતી માસિક]

આ તંત્રી: કૃષ્ણ માનસંગુજ બારદ

માલકેશ્વર મહાદેવનું મંદિર : વીરપુર



[ચિત્ર ૪ : પા. ૧૪]

મીનળવાનો એકગવાલ્ય : વીરપુર



[ચંદ્ર ૨ : પા. ૧૨]


[ટાઈટલ પાના ૨ઠું ચાલુ]

સાથે હોઈ સંબંધ પણ હાથ લાગતો નથી. યતપથ ભાજાણુ (૧૩-૫-૪-૨૨) માં કારીના એક શાખાવી તરીકે નિર્દેશ થયે છે. આ ધૃતરાષ્ટ્ર અથમેધ મજૂ છરવા ચાહતો હતો, પરંતુ થાત્રાનિત થતાનું એને પરાપ્રથમ આપેયો હતો. થાત્રાનિત થતાનીઃ ભારત હતો તેથી એટસું સ્પષ્ટ થાય છે કે કારીના રાણ ધૃતરાષ્ટ્ર ભારત નહોંતો. કાઢ સંહિતામાનો એક દાલદ્વારા પંચાલ હતો એમ ધારી જઈયે તોપણ ધૃતરાષ્ટ્ર વૈચિત્રણીં ઝડુ-વથનો હતો. એ નક્કી છરવું મુસ્કેલ છે, તેથી એ અનેમો વિશાળ ઝડુ-પંચાલનો હેંપાણું પણ એટેનું ચરણ નથી. શતાનીકના પિતાનું થા પૂર્વાંત્રું નામ યતપથ ભાજાણુમાં ‘સત્રાનિત’ છે; એ પદ્વાનના વૃજિષુની પથી પેઢીનો છે અને ઝડુંચાયી ધૃતરાષ્ટ્રનો સમજાલીન છે, પણ એ ધૃતરાષ્ટ્ર તો કાશીનો છે એટથે હોઈ મેળ મળતો નથી. આપણે જોયો એ ચંતોષ કષ થાયો કે કાઢ સંહિતાના ધૃતરાષ્ટ્રનો પિતા કે પૂર્વાં વિચિત્રણીં હતો.

—તાત્રી

૪

વીરપુરાનાથનું ડેકું : વીરપુર



[ચિત્ર ૧ : પા. ૧૧]

ઈતિહાસની આરસીમાં

૧૫. વિચિત્રવીર્ય, ૧૬ ધૂતરાષ્ટ્ર :

કાદકચંદ્રિ (૧૦-૧) માં અઠ દાદર્થ સાથે નેતે સધખ થયેલો તેવા ધૂતરાષ્ટ્ર વિચિત્રવીર્ય ("વિચિત્રવીર્યનો પુત્ર")નો કલ્યાણ થયેલો છે. પોરાણી વાચાવલીમાં તો ચાતુરુના એ પુત્રો ચિત્રાંગભ અને વિચિત્રવીર્યનો સ્પષ્ટ નિર્દેશ થયેલો છે. આમાંના વિચિત્રવીર્યના નાથ પુત્રો તે ધૂતરાષ્ટ્ર પાંડ અને દાસીપુત્ર વિદુર, આવી હોઈ વિમત પ્રાચીન સાહિત્યમાં મળતો નથી, એટલું જ નહિ, એ ધૂતરાષ્ટ્રને 'કુરૂપાંચાથ'

[ટાઇપલ પાના ૩ ઉપર ચાલુ]

પણિક

'પણિક' પ્રતેક અગ્રેજ મહિનાની ૧૫ મી તારીખે પ્રસિદ્ધ થાય છે. પણિકના ૧૫ હિસ્સમાં અંક ન મળે તો સ્થાનિક પોસ્ટ એડિસમાં લિખિત ફરિયાદ કરવી અને એની નકલ અમ્ભે મોકલવી.

૦ 'પણિક' સર્વોચ્ચો વિચાર-બાવાના અને શુનતું માસિક છે. જીવનને જીવણાભી જીવનતાં અભ્યાસપૂર્ણ અને શિષ્ટ મૌલિક કષાણાને સ્વીકારવામાં આવે છે.

૦ પ્રસિદ્ધ ચર્ચા ગરેલી કૃતિને ફરી પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની લેખણી કાળજી રાખી.

૦ કૃતિ સારા અક્ષરે શાહીથી અને કાળજીની એક જ બાજુએ લગેલી હોની લેઠાયે. કૃતિમાં ક્રોધ અન્ય ભાગાનાં અવતરણ મૂક્યાં હોય તો એનો ગુજરાતી તરજૂમે આપવો જરૂરી છે.

૦ કૃતિમાં વિચારાની જવાબદારી કોઈકની રહેશે.

૦ 'પણિક'માં પ્રસિદ્ધ થતી કૃતિ-ઓના વિચારો—અભિયાયો સાથે તા'ની સહમત છે એમ ન સમજતું.

૦ અસ્તીકૃત કૃતિ પાણી મેળવવા જરૂરી રિકિયો આવી હોય તો તરત પરત કરશે.

૦ નમૂનાના અંકની નકલ માટે ૪-૫૦ ની ટિકિયો મોકલવી.

મ. જ્યો. દ્રાક્ષણ પદ્મ. લેઝા પણિક કાર્યાલય, મધુવન, એલિસાથિન, અમ.-૩૮૦૦૦૬ એ સ્થળ મોકલો.

પણિક]

આદ તા'ની : સ્વ. માનસંગળ પારાં
તા'ની-મંદળ () વાર્ષિક લબ્ધાજમ : દેશમાં રૂ. ૩૦/-
ડૉ. કે. કા. શાસ્કી () વિદેશમાં રૂ. ૧૧૨/-, સ્ટુક રૂ. ૪/-
૨. ડૉ. નાગભાઈ ભટ્ટી, રૂ. ૩૧. ડૉ. ભારતીયહેન રોલત

૧૯૮ [૩] ચૈપ, સં. ૨૦૪૬ : એમિલ, સને ૧૬૬૩ [અંક ૭]

અનુક્રમ

મહિલાસની આરસીમાં	તા'ની મુખ્યપૂર્ણ ૨
મેવાળા મહારાણા ઉદ્ઘાસિંહજી શ્રી સંજનસિંહજી ગોહિલ ૨	
અને પ્રતાપસિંહનો પરિવાર	
કરું મહિલાસ પરિષદ્ધું પ્રથમ શ્રી પ્રતાપ નેહી	૪
જાનક્રમ-ધોળાવીરા	
વીસનગર અને ગાયકવાડો	શ્રી નરેશકુમાર ને. પરીખ ૮
વીરપુર એક જાતીગળ લોમકા	પ્રે. ચંદ્રકાંત અચ. જોશી ૮
કાઢિયાવાડ રાજકુમાર પરિષદ્ધની	પ્રે. કલેનાયહેન શ્રી. માણેંક ૧૬
કામગીરી અને એનું મુખ્યાંકન	

વિનાંતિ

વાર્ષિક આહકોણે પોતાતું કે પોતાની સંસ્થા કોલેજ યા શાળાતું લબ્ધાજમ રૂ. ૩૦/- હું ન મોકલ્યું હોય તો સત્તર મ. જ્યો. થી મોકલી આપવા હાર્દિક વિનાંતિ. સરનામામાં જોણ વતુંલમાં પહેલો અંક કયા માસથી આહક થાયતું કહે છે. એ માસ પહેલાં લબ્ધાજમ મળતું અભીષ્ટ છે. આગાઉના લબ્ધાજમ એક કે એકથી વધુ વર્ષોના બાકી છે તેઓ પણ સર્વેણ મોકલી આપવા દૃષ્ટા કરે. અંક હાથમાં આવે એ ગાળામાં લબ્ધાજમ મોકલી આપનારે આવા વર્ષુંને ધ્યાનમાં ન લેવા વિનાંતિ.

'પણિક'ના આશ્રમદાતા રૂ. ૧૦૦૧/- થી અને આજીવન સહાયક રૂ. ૩૦૧/- થી થાય છે. બેટ તરીકે પણ રકમો સ્વીકારવામાં આવે છે. સ્વ. શ્રી. માનસંગળભાઈના અને 'પણિક'ના ચાહકોને 'પણિક કાર્યાલય'ના નામના મ. જ્યો. કે દ્રાક્ષણી મોકલી આપવા વિનાંતિ. આ છેલ્લો એ પ્રકારની તેમ રૂ. ૫૦ થી લઈ વધુ આવતી બેટની ૨૫મ અનાતી જ રહે છે અને એનું માત્ર વ્યાજ જ વપરાય છે.

લબ્ધાજમ પૂરું થાય ત્યાએ તરત મોકલવા વિનાંતિ.

એમિલ/૧૬૬૩

[૧]

મહારાણા ઉદ્ઘાસિંહજીના પરિવાર

સંપા. : શ્રી સનજનસિંહજી ચાહિલ

મહારાણા ઉદ્ઘાસિંહજીનાં રાણીઓ :

૧. શ્રી જેવંતકુંવર :- પાદીના અણોરાજ સેનગરા રણધીરોતનાં પુત્રી, એમના પુત્ર પ્રતાપસિંહજી
૨. „ સંધ્યાકુંવર :- ટોડાના પૃથ્વીરાજ સેવાંકી સુરતાણેતનાં પુત્રી, એમના પુત્ર શક્તિસિંહજી-વીરમહેવ
૩. „ જેવંતકુંવર :- માટેયા નોબાધ અમરસિંહોતનાં પુત્રી, એમના પુત્ર જૈતસિંહ.
૪. „ લાલકુંવર :- પંચાયયલું કર્મચારોત પંવારના પુત્રી, એમના પુત્ર કાનસિંહ.
૫. „ ધીરકુંવર :- રાવળ લુણુકરણ ક્રેસલમેરનાં પુત્રી, એમના પુત્ર જગમાલ-સગર-અગર-રિંડા-પચાપણ.
૬. „ વીરકુંવર :- દેવલાડાના રાજરાણા જૈતસિંહજીનાં પુત્રી, એમના પુત્ર શાર્વલ-કુરસિંહ - સાયણ.
૭. „ ગણેશકુંવર :- (એમના પિતાતું નામ જલ્દાયું નથી.) એમના પુત્રતું નામ નાગરાજ.
૮. „ લાલાકુંવર :- પૃથ્વીરાજ રાડોડનાં પુત્રી, એમના પુત્રો સિંહા-સુલતાન અને લણુકરણ.
૯. „ કનકકુંવર :- મહેચા રાયસિનાં પુત્રી, એમના પુત્ર મહેશાદાસ-વીરમહેવ.
૧૦. „ સાઈતકુંવર :- રતનસિંહજી ખોચીનાં પુત્રી, એમના પુત્ર જોપાળહેવ.
૧૧. „ વીરકાઢાકુંવર :- ખોચી માનસિંહનાં પુત્રી.
૧૨. „ ગોપાલકુંવર :- ખોચી લારસિંહનાં પુત્રી.
૧૩. „ વીરકુંવર ;- અષ્ટયુનર કનકસિંહનાં પુત્રી.
૧૪. „ પારકુંવર :- રાડોડ ભીવસિંહ જૈતાણુંનાં પુત્રી
૧૫. „ કેલકુંવર :- રાડોડ રાવ કલ્યાણમથ બિકોનેરનાં પુત્રી અને રાવ જૈતસિંહજીનાં પૌત્રી.
૧૬. „ લાલકુંવર :- દેવલા બનેસિંહનાં પુત્રી.
૧૭. „ લાલકુંવર :- વાંદેલા (ચૌહાણ) દુરજાણસાલનાં પુત્રી.
૧૮. „ કૃષ્ણકુંવર :- અમરસિંહ ગોઢળનાં પુત્રી.
૧૯. „ શુદ્ધસુખાદ :- ચૌહાણ પારય છણનાં પુત્રી.
૨૦. „ કંપરાહે : રાડોડ જૈતસિંહજીનાં પુત્રી.

નાયર ૧૩ થી ૨૦ સુધીનાં રાણીઓના પુત્રોનાં નામ નથી. બડા (બારોટ) દેવીદાનની જ્યાતમાં આ પ્રમાણે જલ્દાયું છે. બડા દેવીદાન અને શ્રી ઓંઝાળો મહારાણા ઉદ્ઘાસિંહજીના ૨૫ પુત્રો અતાંધા છે, જ્યારે ‘વિરવિનોદમાં ૨૪ પુત્રો અતાંધા છે, કે નાચે સુનાથ છે :

- | | | |
|-----------------------|------------------|------------------|
| ૧. કુંવર પ્રતાપસિંહજી | ૫. કુંવર જૈતસિંહ | ૮. કુંવર અગર |
| ૨. „ શક્તિસિંહજી | ૬. „ રામસિંહ | ૧૦. „ પંચાયણ |
| ૩. „ ધાનસિંહ | ૭. „ જગમાલ | ૧૧. „ નારાયણહાસ |
| ૪. „ વીરમહેવ | ૮. „ સવર | ૧૨. „ સુલતાનસિંહ |

१३. कुंवर लक्ष्मणरेणु	१७. कुंवर उद्दिसिंह	२१. कुंवर नागराज
१४. „ महेश्वरसंजु	१८. „ भावसिंह	२२. „ वैरीसाल
१५. „ योदेहसिंह	१९. „ नेतसिंह	२३. „ भानसिंह
१६. „ शार्दूलसिंह	२०. „ सिंहा	२४. „ साहीअसिंह

महाराष्ट्रा प्रतापसिंहानां राष्ट्रीयोः :

१. श्री अमेलकटे :- राव प्रतापसिंह यौहाणां पुत्री.	२. अब्दुल्लाह :- राव भमाराय पंवारानां पुत्री अने राव अभरहेवना पौत्री, अमना कुंवर अभरसिंह
३. „ यांपाकुंवर :- आवा नैतसिंहानां पुत्री	
४. „ कृष्णकुंवर :- राठोड भोजराजानां पुत्री, राव मालहेवनां पौत्री	
५. „ रतनकुंवर :- राव नगभाव पंवारानां पुत्री	
६. „ कृष्णकुंवर :- राव राम राठोडानां पुत्री अने राव मालहेव लेखपुराना पौत्री	
७. „ असोदाकुंवर :- यौहाणु करमसेवानां पुत्री	
८. „ रतनकुंवर :- राव भानसिंह राठोडानां पुत्री	
९. „ भगवतकुंवर :- यांवडा राठोड लाभानां पुत्री	
१०. „ घारकुंवर :- राव राम सोलांडानां पुत्री	
११. „ सालीभाटाळ :- राव सुलतानहेव हाडानां पुत्री	
१२. „ भधिएकुंवर :- राव अभेराज राठोडानां पुत्री	
१३. „ आसदुंवर :- राव रायभाव भींचीनां पुत्री	
१४. „ रथेकुंवर :- पूर्वीराज राठोडानां पुत्री	

महाराष्ट्रा प्रतापसिंहानां कुंवरोः :

१. कुंवर अभरसिंहानु :—अब्दुल्लेना पुत्र	१०. „ संवलदासालु :-
२. „ नाथादेव :-	११. „ गोपालदास :-
३. „ कर्यारादेव :—यांपाकुंवर आली राष्ट्रीना पुत्र	१२. „ असवंतसिंह :—अमेलकटे यौहाणु
४. „ सहस्रमल :—घारकुंवर सोलांडी राष्ट्रीना पुत्र	१३. „ रायभाव :-
	१४. „ हुर्जनसाल :-
५. „ भगवतानहास :-	१५. „ सुभगु :-
६. „ रामसिंह :—आसदुंवर भींची राष्ट्रीना पुत्र	१६. „ कल्याणास :—असोदाकुंवर यौहाणु
७. „ हाथीभाटाळ :- „ „ „ „	१७. „ पूरणुभाव :—सालीभाटाळ हाडा राष्ट्रीना पुत्र
८. „ चांदाळ :- „ „ „ „	१८. „ शेखाळु :—कृष्णकुंवर राठोडाना पुत्र
	कविराज स्यामलदासल, 'वीरविनोद'ना लेखक अने श्री ओळाळ भटवा डेवीडानी कुंवरोनी आ छाइक अंगे सहस्र होपातुं जणायुं छे. नम्बर २-५-६-१०-११-१३-१४-१५ नां भाता-ओनी विगतो भजा नथी.

६. राजस्थली, पो. उमराणा-३६४३०

परिक्रमा]

अमित/१६६३

[३

કંઈ છતિહાસ પરિપદતું' પ્રથમ જ્ઞાનસત્ર-ધોળાવીરા

કંઈ છતિહાસ પરિપદતું' પ્રથમ જ્ઞાનસત્ર તા. ૨૭-૨૮ હૈયુ. ૮૩ ના રોજ ધોળાવીરા મધે રાખવામાં આવેલ હતું. આ જ્ઞાનસત્રમાં કંઈના છતિહાસમાં મહાનવતું' સ્થાન ધરાવતા કંઈકોટ વિશેના નિષ્ઠાઓનું વાયન, ધોળાવીરા ઉત્પન્ન ક્ષેત્રનું' જાતનિરીક્ષણ, કંઈકોટ રવેચી રાપર તથા કાગેશ્વર મહાદેવ વેરે પ્રાચીન સ્થળોની સુલાક્ષણ પણ કરવામાં આવેલ હતી, જેમાં પરિપદના ઉપનેટલા સંઘોચે ભાગ લાવેલ હતો.

ભારતીય પુરાતત્વ આતા તરફથી ધોળાવીરા ઉત્પન્ન ક્ષેત્રની સુલાક્ષણ લેતાં આજથી ચાર કે પાંચ હજાર વર્ષ 'પહેલાનું' સમૃદ્ધ નગર જાણે જીવત થઈ ગયું 'હતું'. હાર્પોય સંસ્કૃતિના એક ભાગ સમાન ગણ્યાનું' આ નગર આજ સુધીમાં મેળે પાંચ મહાનગર પેઢાનું' એક 'હતું' એમ ઉત્પન્ન કાર્યકાર સંભાળતા વરિષ્ઠ પુરાતત્વવિદ શ્રી મિસ્ટે જણાયું' હતું. એમણે સૂતકાળનાં અધ્વારાં ઉદ્દેશ્યાં વધુમાં જણાયું' હતું' કે વેચાના જે વર્ષનું ત્રિપુર એલદ્દે કે જીવ નગરનું' જેવા મળે છે તેવું' જ આ નગર હતું. એની રચના નિસ્તરીય જેવા મળે છે. પ્રથમ ઉત્્ત્ય સ્તર, ત્યારાદ મધ્યમ સ્તર અને પછી નિમ્ન સ્તર. પ્રથમ સ્તરમાં રાજ અથવા શાસન ચલાવનાર લોકો રહેતા હતા, જ્યારે મધ્યમ સ્તરમાં શાસન ચલાવવામાં મહાદ્રષ્પ લોકો શૈખાઓ રહેતા હોવા જોઈએ, જ્યારે નિમ્ન સ્તરમાં કારીગર વેરે પ્રકારના લોકો વસ્ત્રા હોવા જોઈએ. જેમેમાં છાંનોની તથા સ્થાપયકલાનું' જીન ઉત્્ત્ય સ્તરનું' હતું. રવેચી પુર કિલ્વાની દીવાલથી રક્ષિત જેવા મળે છે. જ્યારે ઉત્્ત્ય સ્તર અને મધ્ય સ્તર વચ્ચે એક મેડું' સ્ટેડિયમ અથવા રંગભૂમિ જેવા મળે છે, જેમાં નગર-ઉત્સવ સમારંભ વગેરે યોગદાન હોય.

આ નગરમાં પાણીની વ્યવસ્થા જેનમુન જેવા મળે છે, એક માથસ આપો ચાલો જય એવી ભૂગર્ભ નહેર આખા નગરને પાણી પૂરું' પાડતી હતી. ખરેખર જેતાં ન ધરાઈએ એટલી અહુમૂલ્ય વરતુંનો. ત્યાંથી મળી રહી છે.

ધોળાવીરા આતે શ્રી મિસ્ટેતું' શાલ ઓઢાડીને સંમાન શ્રી વાયુલા જાહેનાએ કર્યું' હતું, જ્યારે ધોળાવીરાના છતિહાસમાં આગ્રા' પ્રદાન કરનાર શ્રી શાંખુદાન ગઢવીનું' સંમાન શ્રી પ્રદીપ લેશાએ કર્યું' હતું' તથા સર્પચચ્છી એંગારાલાલી સોઢાનું' સંમાન શ્રી જોરુલા જાહેનાએ કંઈ છતિહાસ પરિપદ તરફથી કર્યું' હતું. કાર્યકર્મનું' સંચાલન જોર નરેન્દ્ર સાગરે કર્યું' હતું, જ્યારે આભારવિધિ શ્રીમતી મંગલાભાઈન જીવીએ કરી હતી.

રવેચી આતે યોન્યેલ નિષ્ઠાધ્વાચયનમાં જોર ચેતના તથા શીલા મીઠિયાએ નિષ્ઠાધ્વાનું' વાયન કર્યું' હતું. રવેચી જનીરતા મહાત્મી મોહનગિરિયે પરિપદને આશીર્વાયન સંભળાય્યાં હતાં' તથા એમનું' પણ શાલ ઓઢાડી સંમાન કરવામાં આવ્યું' હતું. રવેચીનો છતિહાસ શ્રી વેરસીલાઈ લુહારે સમન્યો હતો.

તા. ૨૮ના દિવસે રાપર દરિયાસ્થાન મધે ચાલતી રામકથામાં પરિપદના સંઘોચે જોડાયા હતા. કથાકાર શ્રી પુરુષોત્તમદાસજી મહારાજનું' શાલ ઓઢાડી સંમાન કર્યું' હતું. કંઈ છતિહાસ પરિપદના ઉપપ્રમુખ શ્રી પ્રાણગિરિ ગોસ્વામીએ પરિપદનો હેતુ તથા જ્ઞાનસત્ર વિશે જાણકારી ત્યાંના લોકોને આપી હતી.

[અતુસંધાન પા. ૧૮ મે]

[अनुसंधान धा. २४ थी]

स्वातंत्र्यो ठरव पछि पसार करवामां आयो होता अने आ परिषदमां हाजर काहेकरो अने प्रजननो प्रेरणातुं ननु लायुं लाई वषु नेमथी काम करवाना निर्धार साथे विजेतासा.

काडियावाड राजकीय परिषद्तुं सातमुं अधिवेशन (१९८६, ब्रांगद्वा) : 'काडियावाड राजकीय परिषद्तुं सातमुं' अने छेल्युं अधिवेशन २ अने ३ नवेम्बर, १९८६ ना हिवसोमां ब्रांगद्वामां दृवार जोपाण्डास देसाईता प्रमुखपटे ६ वर्षा लांबा गाणा पछी मल्युं हुतुं. आ पहेवां १९८१ मां ब्रांगद्वामां परिषद्तुं अधिवेशन ठरवा सामे राजन्ये मनाई-हुक्म फ्रमावतां लडत थयेही, जेमां फूलयं लाई शाह, एमनां वृद्ध मानुशी, एमनां पली शारदायहेन अने भीन काहेकरो उपर खुूँ सितम गुरुरपायामां आयो होतो,^{३१} परंतु १५ वर्षे पछी ऐ ४ राजन्यना वारसहार नव-जुवान महाराज मध्यरध्यजस्िंहलाले ब्रांगद्वामां अधिवेशन फ्रवानी भंजूरी आपी तथा शुभेच्छानो संदेशा पाइनी एमना पितामे करेही लूल सुखारी लीधी होती. आ अधिवेशनतुं ज्ञाहाटन मुंभर्छ प्रांतना गुरुप्रधान भोरारु हेसाईते कुर्युं हुतुं. आ ४७ समये ब्रांगद्वामां काडियावाड अस्पृश्यता-निवारणां संमेलन, भूरू संमेलन अने आहीआगोदोग संमेलन पछि योजनां होतां.

भोरारुलाईते पोताना अवयनां सौराष्ट्राना तामाम प्रश्नोने संवादाही रीते आवरी लीधा होता. राजकोटानी लडत, लीभीनी लडत अने जिजरत, ब्रांगद्वाय तंत्रीनी ज़जरियात, राजन्याना एक्टम अर्था उपर नियंत्रण वजेरे प्रश्नोने छलुवाट की काडियावाडां राजन्येतुं एकम रचवानी ज़जरियात उपर भार मूक्यो होतो. आ अधिवेशनमां श्री रविशंकर महाराजे पछि रचनात्मक कार्य करवाथी स्परान्य भणी शक्तो एनुं कुर्युं हुतुं, तो मुंभर्छ धारासक्ताना स्पीकर श्री भंगद्वास पक्वासाए सौराष्ट्राना २२२ राजन्योतुं एकम रचवातुं सचन कुर्युं हुतुं. एना अनुसंधाने श्री अग्नवंतराय भहेताए रजू ठेक्क सौराष्ट्राना एकमनो ठरव पसार करवामां आयो होतो. ऐ उपरांत प्रमुखस्थानेकी अस्पृश्यतानिवारण अने रचनात्मक कार्यक्रमो ठरव २४४ थतां ऐ संवानुभते पसार थयो होतो. वीरभगवानी लाईनदोरी दूर करवनो तथा लीमोना विकास अंगेनो ठरव पछु पसार थयो होतो. आना भंजीओ तरीके श्री छेलवाई अने श्री अग्नवंतराय भहेतानी पक्वाही करवामां आयी होती. आम, आ अधिवेशन ऐ खुूँ महत्वतुं पुरवाई थयुं, कारण के हिंदी क्षितिज उपर आजाहीनी उपानां दर्शन आ समये ४ काडियावाडानी प्रजनने कर्या अने पोतानी मुक्तिनां एंधाष्ट पछि ज्ञाही.^{३२}

भूद्यांकन : 'काडियावाड राजकीय परिषद्तुं' ऐ समस्त काडियावाडी प्रजना प्रश्नोने वाचा आपानारी एक महत्वनी संस्था तरीके अहार आवी. आपाहुदी अने ईनराशाहीथी अस्पृश्यतां सौराष्ट्रानां देशी राजन्योनी प्रजनां प्रजक्षय जगृति लाववातुं कार्य खूँ कुपुं हुतुं, पछि एम छतां धायी गतियो ऐ कार्य एना कार्यकरो अने आगेवानोना संनिध प्रयासाथी पूँड थई शक्युं हुतुं अने ऐ रीत आ परिषद्ते सौराष्ट्राना प्रजालुबनमां सारित्रय चेतनानो संचारे करवामां अत्यंत भहेतवनो लाग लाजव्यो होतो.

वणा, आ परिषद्ते विकुलबाई पेटेल, अम्बायास तैयायल, बांधीज, सरदार पेटेल हङ्करायामा, दृवार जोपाण्डास नेवा महान नेतामो प्रमुख तरीके प्राप्त थया होता. प्रारंभी ज्ञ आ परिषद्ते गांधीज अने सरदार पेटेलतुं मार्गदर्शन मणितुं रख्युं हुतुं. गांधीज अने सरदार पेटेले आ परिषद्ते कामगारी अंगे केटलीक भर्याओया मुझी होती; जेमेके राज्य राज्य वर्चयेना प्रश्नोनी यच्चा

ને કરવી, વ્યક્તિગત રાજ્યના પ્રક્રિયાને સુપર્ખ્યા નહિ અને સૌરાષ્ટ્રના કાર્યક્રમોએ દેશી રાજ્યોમાં રહીને જ કાર્ય કરતું. ગ્રારંબિક તત્કષેત્ર સૌરાષ્ટ્રમાં પ્રભળમાં પોતાના હક્કો અંગેની લગૃતિનો અભાવ હતો, કોઈ સંગઠન ન હતું, તેથી રાજ્યવાચ્યાના સંદર્ભના વિના એમની પ્રવૃત્તિ આગળ વધી શકે એમ ન હતું, તેવા એમણે ઉપર્યુક્ત નિયમણે મુહૂર્ચાં હતાં.

૧૯૨૦ થી ૧૯૪૪ ના ૨૬ વર્ષના ગાળા દરમ્યાન આ પરિયદનાં કુલ સાત અધિવેશનો થયાં તેમામાં એનેક દરાવો થયા, એનાથી મુખ્ય રચનાત્મક કાર્યક્રમો અંગેના હતા, જેવા કે આદી, અસ્પૃષ્યતાનિવારણ, આમેદ્યોગનો વિકાસ અને દ્વારાધી, વળા, આ પરિયોની સાથે સાથે વિવાર્થી. પરિયદ યુવક-પરિયદ મજૂર-પરિયદ વરેણેના અધિવેશનો થયાં હતાં. એનાથી પ્રભળના વિવિધ વર્ષમાં લગૃતિ આવી હતી. આ પરિયદના જનક તો મનુસુખમાટે ર. મહેતાને ગણ્યવામાં આવે છે.^{૩૪}

પરિયદની પ્રવૃત્તિનો પ્રસાર કરવામાં “સૌરાષ્ટ્ર” સાચાદિક મહત્વનો ફિલો આપો હતો. એ સૌરાષ્ટ્રની પ્રભળની માગણ્યોત્તું મશ્શાલચી બન્યું હતું.

આ પરિયદના માર્ગદર્શન હેઠળ જ સૌરાષ્ટ્રના એનેક કાર્યક્રમોએ સૌરાષ્ટ્રમાં અને ખ્રિસ્તિના હિંદુમાં થયેલા એને સત્યાગ્રહમાં ભાગ લાવીએ હતો; જેમ કે નાગપુરના અંડા-સત્યાગ્રહમાં, બારડોલી-સત્યાગ્રહમાં અને માંડા-સત્યાગ્રહમાં ભાગ લાવીએ હતો, તો સરખસો ખિડકર-સત્યાગ્રહ, ધેરેલા અને પીરમગામના મીઠાના સત્યાગ્રહો, ૧૯૩૧ ના પ્રોણ વણોદ મોરણી દ્વારાગ્રહના સત્યાગ્રહ, રાજકોટ-સત્યાગ્રહ, લીંઅહી-સત્યાગ્રહ અને ૧૯૪૪ ના ‘હિંદ છોડો’ આંદોલનમાં મોટી સંઘયામાં ભાગ લઈ સંઝગતા મેળવી હતી. ‘હિંદ છોડો’ ચણલન દરમ્યાન તો આ પરિયદના નેતાઓના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ તળાજ ગઢા વગેરે સ્થળોએ સલા સરખસો હડતાલ પિક્ચિંગ વગેરે કાર્યક્રમો યોજાના હતાં.^{૩૫} ૧૯૪૪ માં જૂનાગઢે પાડિસતાન સાથે જોડાયું કરવા સામે જૂનાગઢની મુક્તિ માટે ‘આરજી હુક્મત’ સ્થપાઈ હતી, એ પણ ‘કાદિયાવાડ રાજકોય પરિયદાંતુ’ અચારનાર માર્ગદર્શન મેળવી આગળ વધતી હતી. આમ, જૂનાગઢનાં પ્રદેશ અને પ્રભળને મુક્તિ અપાવનાર ‘આરજી હુક્મત’ના લહતેને સંઝળ બનાવવામાં પણ ‘કાદિયાવાડ રાજકોય પરિયદાંતુ’ ફણો મહત્વનો રહ્યો હતો. આમ આ પરિયદે સૌરાષ્ટ્રની પ્રભળમાં રાણ્યિય લગૃતિ પ્રગાવવામાં અમૃત્ય ફણો આપો હતો.

આમ, ‘કાદિયાવાડ રાજકોય પરિયદે’ સૌરાષ્ટ્રના દેલી રાજ્યોની પ્રભળમાં રાજકોય તથા રાણ્યિય લગૃતિ બાવવાનું કામ તો કર્યું જ હતું, પણ સાથે સાથે આદીકામ, દ્વારાધી, અસ્પૃષ્યતા-નિવારણ, રાણ્યિય શિક્ષણ, સ્વભેદાને ઉત્તેજન, મજૂરોના વિકાસની પ્રવૃત્તિ વગેરે દ્વારા પ્રભળના સામાનિકતે તેમજ આધીકન ઉત્ત્થાન માટેના પ્રયત્નો કર્યા હતા, તેથી એમ કઢી શકાય કે ‘કાદિયાવાડ રાજકોય પરિયદે’ ગાંધીયુગમાં સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ રાજકોય લગૃતિ અને સામાજિક તથા આધીકન પ્રગતિ લાભવામાં સહાયક બની હતી.’ એના સંનિહિત સતત પ્રયાસોને પરિયદે ૨૨૨ કુહાણોમાં વહેંચાયેલો પ્રદેશ ડ. સ. ૧૯૪૮ માં “સંકુક્ત સૌરાષ્ટ્ર” નામના રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યો અને રાજ્યોના યુગની સમાપ્તિ થઈ તથા પ્રભળકીય શાસનના યુગનો પ્રારંભ થયો.^{૩૬}

સંદર્ભ

૧. મેનન. વી. પી. ધી. સ્ટોરી ઓફ ધી ખનિયન સ્ટેટ્સ, સુંઅઠ, ૧૯૬૬, પૃ. ૧૬૮
૨. એઝા ડેવણરામ સી., રિકન્સ્ટુક્શન એન્ડ લાઇસન્સ એન્ડ પોલિસી ઈન કાદિયાવાડ સ્ટેટ્સ, રાજકોટ, ૧૯૪૬, પૃ. ૭

3. प्रै. जनी, एस. वी., 'भारतनो स्वातंगसंग्रह अने सौराष्ट्र', श. ई. परिषद्-लाखुवड
गानपत्र, १९८२, की-पेपर, पृ. २
४. हेडर, उच्चरंगराय-इरभार गोपालगांव, मुंगई, १९६४, पृ. ६
५. डॉ. जनी, एस. वी., स्वातंग लहल हरयान गुजरातमां प्रभक्षय भंडोनो फोगो-नामो
लेख, 'अर्थात्', सुरत, अंथ-१०, अंक-ओ-एकोटा. नवे. १९८१, पृ. १०
६. चूहगर, भी. एक., धनियन ग्रिन्सेस अन्डर लिटिश ओरेक्यन, बंडन, १९८६, पृ. २१५
७. आवनगर हिस्ट्रिक्ट गेटिटियर (अंग्रेजमा)-अमहावाद-१९६६, पृ. ८५-८८
८. शाह, कांतिलाल, सौराष्ट्रमां गावीण, राजकोट, १९७२, पृ. ३३
९. राजकोट द्वातर लंडार-द्वातर नं. २, फाईल नं. २२, पृ. ७३
१०. शाह, कांतिलाल, पूर्वोक्त अंथ, पृ. ३३
११. अद्विक्षुवन, (सं'अहकर्ता), संस्थाना राजकोटनी डिरेक्टरी, लाग-१, राजकोट, १९८६, पृ. १७१
१२. शाह, कांतिलाल, पूर्वोक्त अंथ, पृ. ३६
१३. डॉ. राजगोर, शिवप्रसाद, गुजरातनो राजक्षय अने सांस्कृतिक उत्तिहास, अमहावाद, १९७४,
पृ. १८८
१४. डॉ. जनी एस. वी. नो पूर्वोक्त लेख, 'अर्थात्', पृ. १२-१३
१५. शास्त्री ड. ग. अने परीष ग्र. वि. (सं'पा.)-गुजरातनो राजक्षय अने सांस्कृतिक उत्तिहास,
अंथ-८, अमहावाद, १९८७, पृ. १३०
१६. एजन, पृ. १३१
१७. शाह, कांतिलाल-पूर्वोक्त अंथ, पृ. ४७
१८. मेवाणी एम. वी. नो लेख-काठियावाड राजक्षय परिषद्, श्री कृ. डॉ. शास्त्री ज्याल अंथ. गोर.
अंदर, १९८१, पृ. १५१
१९. राजकोट द्वातर लंडार, द्वातर नं. २, फाईल नं. २२, पृ. ८६
२०. एकांश, धनवंत, लवित, १९६४, पृ. १८
२१. हलाल, यंदुलाल ल. (सं'पा०), महादेवबाईनी दामरी पुस्तक-७ मुं, अमहावाद, १९६५, पृ. २०
२२. "नवज्ञवन", अमहावाद, ८-१-१९२५
२३. डॉ. जनी एस. वी., लेख-का. रा. परिषद्हतुं आवनगर अधिसेशन, 'सामीप्य', अमहावाद,
जुलाई-१९८४, पृ. ११५.
२४. शाह, कांतिलाल, पूर्वोक्त अंथ, पृ. ४८
२५. जनी एस. वी., उभर्युक्त लेख, 'सामीप्य', जुलाई, १९८४, पृ. ११७
२६. शाह, कांतिलाल, पूर्वोक्त अंथ, पृ. ८२
२७. एजन, पृ. ८६
२८. शास्त्री अने परीष, पूर्वोक्त अंथ, पृ. १३२
२९. शाह, कांतिलाल, पूर्वोक्त अंथ, पृ. १०१
३०. एजन, पृ. १०१-१०३
३१. एजन, पृ. २०२
३२. शाह, जयापहेन (सं'पा.), सौराष्ट्रना स्वातंग-सैनिका अने लडो, राजकोट, १९८८, पृ. २०४
३३. शाह, कांतिलाल-पूर्वोक्त अंथ, पृ. १८३
३४. शाह, जयापहेन, पूर्वोक्त अंथ, पृ. २४७
३५. नेशनल आर्काइव्स-न्यू हिल्स-होम डिपार्टमेंट (प्रौद्योगिकी. आर्थ). फाईल नं. ३-६०-४२
३६. जनी एक. वी., पूर्वोक्त लेख, अर्थात्, पृ. १५
३७. उत्तिहास विभाग, सौ. युनि., राजकोट-३६०००५

प्रतिक

अमित/१६६३

[७]

વિસનગર અને ગાયકવાડો

(ગતાંક પા. ૨૧ થી ચાલુ)

ગ્રા. નરેશકુમાર કે. પરીઅ

“આ માન વિસનગરસામી સહગત શેડ ગોડલબાઈ દેલતરામે રા. ૫૦,૦૦૦/-ના ખરોં સત્તા ૧૯૦૭ માં અંધાબુદ્ધ હતું, તે તેમના સ્મરણાર્થે તેમના ધર્માખતી બાઈ ચુનીએ શ્રીમત મહારાજા ગાયકવાડોની સરકારને ક્રા. વિસનગર હાઈસ્કૂલ અને મેટિંગના ઉપયોગ માટે ઉદ્ઘારતાથી આપ્યું છે અને તે હવેથી શેડ ગોડલબાઈ દેલતરામ હાઈસ્કૂલના નામથી એણાખાણે, તા. ૧૮ મી જૂન ૧૯૧૭.”

આમ ગાયકવાડ રાજ્યના અમલ દરમાન શ્રીમત સ્થાન્યરાવ ક્રીલના રાજ્યકાલ દરમાન વિસનગરનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ થયો હતો. વિસનગરની પ્રદૂતિનો એ સુવર્ણકાલ હતો. વિસનગરમાં એમતું શાસન લ્યાં લાંસુંચી ચાલું. (ઇ.સ. ૧૯૮૩ની ૬ જાન્યુઆરીએ અવસાન.)

એમના ચુસુ પાદ પ્રતાપસિંહ ગાયકવાડ ગાદીએ આવ્યા. પ્રતાપસિંહ ગાયકવાડ ગાદીએ આવતાં વહીનીતિનું કથળાં લાગ્યું. સમગ્ર રાષ્ટ્રમાં આજાદીનું વાતાવરણ મધ્યાહે હતું અને લ્યારે રાજનાયાદી રાજ્યેના શાસકો સ્વાધીન રાષ્ટ્રના નિર્માણમાં સહકાર આપી રહ્યા હતા. ત્યારે પ્રતાપસિંહ રાજનાયાદીના મિનાનામાં હતા. અધારાખુસભામાં ૧૯૪૭ માં પોતાના પ્રતિનિધિ મેઝાલી આપનાર વડોદરા રાજ્ય પ્રથમ હતું, તો ભીજુ પ્રતાપસિંહે પોતાના અભિય ગુજરાતના સરેપિરિ રાજ જનાવાની માગણી કરી, પરિદુઃખ આ માગણુંનો અસ્વીકાર થતાં ૧૯૪૮ માં ભારતસંધી સાથે વડોદરા રાજ્યનું જોડાયું થયું. ૧૯૮૮ ના રોજ પ્રતાપસિંહના જહેરનામા પ્રમાણે અનેલી કારોઅારી સમિતિએ મુખ્ય પ્રાંત સાથે જોડાયુંનો દરાવ કર્યો. ૩૧-૧-૧૯૪૮ ના રોજ પ્રતાપસિંહ વડોદરા રાજ્યનો જોડાયુનો નિશ્ચય કર્યો ૨૧-૩-૧૯૪૮ ના જોડાયું કરાર ઉપર સહી થઈ. ૧-૫-૧૯૪૮ ના રોજ મુખ્ય સરકારે વડોદરા રાજ્યનો વહીના સંભાળી લીધ્યો.

૬. ગ્રાન્થિકાયાનો આંગે, દરધારારોડ, કચેરી પાસે, વિસનગર-૩૮૪૩૧૫

સંદર્ભ-અથસૂચિ

૧. વડોદરા રાજ્યનો ભતીહાસ, ચુનીવાલ મગનલાલ મહેતા
૨. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ભતીહાસ અથ-૭ (મરાઠાકાલ) રસિકલાલ છોટાવાલ પરીઅ
૩. વડોદરાનરેખ શ્રીમત સ્થાન્યરાવ ગાયકવાડ ક્રીલ, ભાગ ૨, વિમનલાલ મ. ડોકટર
૪. શ્રી સ્થાન્ય હીરક મહેલાસ નિવેહન ભાગ ૧ લો, રા. બા. ગોવિંદભાઈ હાથીભાઈ કેસાઈ
૫. ગુજરાતના રાજનાયાદી રાજ્યો : વિલીનિકરણ અને એકીકરણ, વિદ્યાપીઠ-મે. જૂન ૧૯૮૬, રા. પરીઅ
૬. ગુજરાતના સિક્ષણો, આચાર્ય નનીનન્દ આ.
૭. ભારતનો ભતીહાસ (મરાઠાકાલ), મનુષ્યાઈ થી. શાહ
૮. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ભતીહાસ, ડો. શિવપ્રેસાદ રાજનોર
૯. વડોદરા રાજ્યનું ધારણા, દ્વારોદર ગોવિંદ માલસે
૧૦. વિસનગર... ડો. રમણલાલ નાગરણ મહેતા
૧૧. શતાબ્દીસમરણ મંજુધા, પ્ર. પારોખ વલ્લબ્ધરામ હેમચંદ્ર લાઘુબેરી સપા. સમિતિ વતી, પ્રિ. કિ.તેન્દ દવે
૧૨. શ્રી મહારાજા સ્થાન્યરાવ ગાયકવાડ, એંગ્રોઝીનાં વ્યાખ્યાનો અને ભાષણો, ધીરજલાલ ડો. શાહ
૧૩. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ભતીહાસ અથ-૮ (આજાદી પહેલા અને આજાદી પછી)
- પ્રકાશક : પ્રીણિયંડ પ્રિ. પરીઅ સપાક્ષ : હિંગ્રસાદ શાસ્ત્રી
૧૪. વિસનગર અને વડોદરા રાજ્યની હણીત, પ્રથમ અને દ્વિતીય આયતિ, મહાચુખભાઈ ચુનીવાલ
૧૫. 'Forty Years in Baroda', R. B. Govindbhai H. Desai

‘वीरपुर एक भातीगण लोमका’

ज्ञा. यंदकांत अस्य. जेरी, ‘अट्टिकन’

प्रास्तविक पृष्ठभूमि : भामणेश्वर-पोरबंदर ८-५ ना. राष्ट्रिय धोरी भाग पर आवेलु वीरपुर गाम गोडाणना नेकांचे १६ डि. भी. अने वेतपुरी ईशाने १३ डि. भी. दूर्दुख १९६६-८८ एकर जमीनना क्षेत्रफलमां उल्ली गळतरी मुजल ६७७ माझसोनी वस्तीने पोतामां संग्रहीने पथरायेलु छे. “The Bhadarkantha Directory”ना प्रथम भागमां भानउहाद्दुर हरामरोज सोराभाग मास्टरनी केटविक प्रकारू नोंद्या तस्य “Western India State Agency Civil list 1940” तेमज “History of Kathiawar” अने “Gazetteer Bombay Presidency, Vol. V” वरेमांथी मानी वेविप्रेर माहिती मुजल वीरपुर राजधानीमां चोया वर्णनू, परंतु अति नामना भेजवेलु राज्य अने अरेठीनी इकराततुं मुख्य गाम हुं, ए जामनसरतुं भायाती राज्य हुं. वीरपुरमां कुणना स्थापक तरीक जम विकाणना दुंवर जम सताणना लाई भाष्यल हला एम भानवाने प्रस्तुत नोंद्या. प्रेरे छे, करण्य के वीरपुरतुं राजवाहिकुण नवानगरना कुणनी शाखा छे. मुस्कमान याथवरोना वर्च्यसोने तोडीने ज वीरपुरने राज्य अने राजधानी (१२ गामेना) अनाववामां आव्युं हुं. जलगण्यानां दृष्टिकों. १८१ ना आणागाणानो समय जाती गांधी. ज्ञमनगर गोंडण वेवां ए समर्थ राज्योनी सरहडी तक्रारोना अवारनवारना मुनरावर्तनने लिहि आम करवानी जवरियात जली थांडी होवातुं जलाय छे. पक्षीथी वीज वर्णने दरबने ग्रापत थथेलो.

परंतु आ राज्याय परंपरामांथी कोई महत्वनी द्वितीय सांपडी होय तो. ए आर्यसमाज वियारधारानी हली, नेता परिपाळकपे निरायेलु ‘वेदमन्त्रि’ आने पाण वीरपुरमां अनी साक्षी पूरी पाडे छे. जम रावणना अनुवंशज मेकाण त्रिभवे वीरपुर जलाने राजधानी अनाव्या पठानी पांचमी घेठीगे आवेदा सुराण ठांडोरे भूर्तिपूजनो. त्याग करीने स्वामी ह्यानंद सरस्पतीना आर्यसमाजने अपनाव्या. तेविधाना अडु अडु अडु सराण ठांडोरनी द्वा करवा माटे वीरपुर आवेदार अमेनो व्यापक प्रसाव पथरायेल रहेतो.

पेतानां जवनसंस्मरणानी “अवनपथ्यना नामे आपक्या लघ्यनार विघ्यात साहित्यकार धूमडेतुं” (पा. २७-२८ प२) जल्लाव्यु छे के “एक वपत लाला लज्जपत्राय अने तिळक महाराजना जमानामां कडवाय छे के अंबेज सरकारनी काणी के वाहणी ने काई चोपडी अना राज्याय आतामां रायाती होय तेमां नामे अववातुं भान आ भायेज १८००-१८५०ती वस्तीवाणा वीरपुरने गज्जुं हुं.” आवा वीरपुरने जलारमण्युं कडीगे, धूमडेतुं कडीगे के पछी असिंह अनिहासिक भीनणवाववाणुं गाम कडीगे.

आ सराण ठांडोर गीण(भाष्य ठांडोरथी भारभी ऐही)मे द्विलिस नामना येविटिक्स अेजन्टनी शान ठेकाणे लाववा ये अेजन्टना ज अंगलामां तववार ऐंचेली अने अेजन्ट कु धी गवनर-जनरले समय पारभीने पोताने अंगले पार्टीतुं आयोजन करीने, सराणने आस निमंत्रण आपीने द्विलिस पासे “हेवेथी काथिंच्यावारना कोई राजवातुं अपमान नहि करु”नी भांहुवरी अपावेदी. आजना तेताअेनी डीनर-डिप्लोमसीनां मूऱ त्यासूधी जवा मागतां ढोरे?

पृष्ठक]

अमित/१६६३

[६

સામેથી વિદ્યા સહતતમાં હિલ્લી અભ્યાસી માગી લેનાર આ પહેલો પોવિટિકલ એજન્ટ હતો. આજે પણ રાજકોટના સદર વિસ્તાર પાસે મોટી ટાંકી સામે વિરપુરનો ડાતારો મોજૂદ છે. લાંનની પોતાની નિવૃત્તિની પછીની લાયેલી ડાપરોમાં ફિલીસે વિરપુરને "Worth Visiting Virpur" તરીકે ઓળખાયું હોવાની નોંધ છે!

એમણે અંગીકાર કરેલા આર્થસમાજને કીથી વિરપુર ભારતભરનું આર્થસમાજનું આગતું કેંદ્ર જીનું ગયું, પંનાં ઉપરાંત પણ પૂર્વ અને હિન્દુશિથી ભૂજોભૂષણી આર્થસમાજના વિદ્યાનો વિરપુર અવતા. શુદ્ધ આર્થાત્ અને હિન્દુત્વના એમો ચુંચ આગામી હતા. કંબિ 'કાંત'ના ઉપનામથી ઓળખાતી ચુંચરાતી ભાષાના એ સમયના સમર્થ સાહિત્યકાર શ્રી મણિશા કર રત્નાલ લાદ ચાવડામદરેલી પાસેથી રાજકોટ રાજકુમાર કોલેજમાં સ્વીઠનથોળું ના પ્રભાવથી પ્રિસ્ટી ધર્મ અંગીકાર કરીને પાછા હિન્દુ ધર્માં ચુંચ વેદાની આત્માનંદજીના ઉપદેશથી આવેલા. એ સિવાય વિચારનંદળું સ્વામી, આનંદપ્રિય ચંદ્રમણિલું, ગોપાળદાસ શર્માં, સ્વામીશ્રી શંકરાનંદજી નેવી આર્થવિશ્વુતિગ્રામાથી વિરપુર પાવન થયેલું છે. (તા. ૧૨-૧૧-'૭૮ ના 'ગુજરાત સમાચાર'માં પ્રગટ થયેલ આ જ લેખકના વીરપુર અગેના લેખમાંથી), આત્માનંદજી સુરાળના પરેમણુરું હતા. કંબિશ્રી નાનાલાલે 'કાંત' સાથે એમના ધર્મપરિવર્તનના અરસાથી ત્યાર પછીની એમની સમાજાનિષ્ઠત્વાની સાથે એમણે 'કાંત'નો પરિયથ ભાવી આશાસપદ કવિ તરફે કરાવેલો. માનસિક રીતે આત્માનંદજી સાથીની સુલાદાત પછી એમજુની હળવાશ અતુલવેલી અને આર્થસમાજનું કામણું થઈ ગયેલું! ધીમા સ્વામીશ્રી નિત્યાનંદ અને પંનાંના આર્થસુનિ ભીમસેનનાં વિદ્યાપૂર્વી વ્યાપ્તયાનોનો વિરપુર પરનો પ્રભાવ તો ધૂર્ભેદુંચે પણ સ્વીકારો છે. ચુંચ આર્થસમાજ હોવા જ્ઞાન સુરાળ વિરપુરના જલારમજીના મંહિરમાં થાં ગીતા-પ્રવન્યનો સાંભળવા પણ જતા. આ એક સંપ્રદાયસંહિષ્ણતાનું અન્ય મિશાળ હતું (આ જ લેખકના ૨૮-૭-'૬૨ના 'આકાશવાણી' પરના ધૂર્ભેદુંચે વાતાવાપમાંથી). દુંડમાં, રાજસત્તા અને ધર્મ અહીંની ભૂમિ પર એક જ સ્તરે દ્વાયાંક્રિયાં, જાગણીની નોઈએ તો રાજસત્તા પર ધર્મ-દંડનો અપ્રત્યક્ષ પ્રભાવ રહ્યો જ છે. મહીંડાના પુનાર તાલુકાઓ સુરિયમ અની ચૂંદો મેલેસાલામ તાલુકારોએ વિરપુરમાં આર્થસમાજની પ્રાણુલી અંગીકૃત કરી, એટલું જ નહિ, પણ યોગ્યતીન પણ ધારણું કરી, વટાળપ્રવર્તિ પર અંકુશાત્મક પ્રભાવ વર્તાવ્યો હતો.

કૈલાંડનગરી : આ વિરપુરની નોમદા વિસે કૈલાંડના મનમાં વાંચવાની, તો અનેકના મનમાં દખાવાની પણ આકંક્ષા થતી આવી છે અને પ્રસંગ્યાત ધ્વંસ લખાડું પણ છે. મૂળે કૈલાંડનગરી અને વિસોતનગરના અવસ્થોમાંથી એ જાલું થયેલું છે। સપેન્થેર-૬૨ ના 'પથિકાં' શ્રી યથંવત દુ. ઉપાધ્યાયના 'કેરાઉથરથી કેરાળીની' પ્રવાસનોંચ મુજબ ભાદરનદી-ગોળાપર વાડી નીદાંડાનો પ્રવાસ લંબાયો હોત અને કેરાળીના માર્ગ પરથી પંથપીપળા આગળ પ્રવાસ પૂરો ન ઝોરો, હોત તો વિરપુર સુધી એમને જરૂર લાંબું થતું પછ્યું હોત, કારણ કે રથારિકા ગામ પાસેના કેરાઉથર મહાદેવ મંદિરની સ્થાપના લીમે કરી હોવાનું મનાય છે. આ જો સ્વીકારાય કે પુરાવા તાર્કિકીને મળી આવે તો આ કોલાંડનગર પાંચવાના સમયથી પ્રચલિત હોવાની માન્યતાને સમર્થન મળે. કૈલાંડનગર તથા પછીથી અનેલી વિસોતનગરી એક ટીંબા ઉપર વસેલી હશે એમ માનવાને ખલ્લા મારણો છે. ભાગવતાચાર્ય શ્રીમનહરલાલજી મહારાજના મેવાસા ગામ યોગ્યાનો રીંબો અને જિજિયા

ટેકરા તરીકે ઓળખાતો હરિપુર ગામ પાસેનો પિંજડિયાનો રીંગો, આ બધા એક જ શુંખલાનાં અનુસંધાનો ગણી શકાય, (પ્રસિદ્ધ ફિલ્મી હસ્તી સ્વ. શ્રી મનમોહન શર્મા મેવાસાના હતા, તો વીરપુર એમનું મોસાણ હતું.)

આકસ્માત્ કુનિવર્સિટીએ ધૂમકેતુની “પોસ્ટ ઓફિસ” વાતાવું અંગ્રેજીનાં ઇપાતર કરીને વિભાગી શ્રેષ્ઠ વાતાવરણાં એને ભૂત્વી એ જ રીતે ચુન્ઝાતના શેફ્ટસપિયર ગણ્યાતા નાટચસાહિત્યકાર સર્જન્ક શ્રી પ્રલુલાલ દિવેશી લેવી વિભૂતિ પણ વીરપુરની ધરતીનું પ્રદાન છે, તો કવિશ્રી નાનાલાલને રમાધનાર કવિશ્રી ગૌરોદાશાંકરની જન્મભૂમિ જોમણા, પરંતુ ક્રમભૂમિ વીરપુર હતી. ચારાજ ડાઢારે એમને ‘રાજકૃપિ’ તરીકે સ્વીકૃત કરેલા, તો ચુન્ઝાત રાજ્યના દી.આઈ.જી. તરીકે રહીને નીતિનિષ્ઠ અધિકારીની નામના મેળેલ શ્રીમંજૂતસિંહજી જહેલ પણ વીરપુરમાં જન્મેલા. કૌલાંઠનગરી કાલક્રમે વિસોતનગરી એને આખરે વીરપુર જન્મે. ‘વિસોતને ડેટલાઇક ‘વિસોત પાટણું’ તરીકે ઓળખાવે છે. બધાં જ પાટણું કે જેણી સંખ્યા ૪૪ હેવાનું જથ્થાય છે તે પાટણના સિદ્ધ પુરુષ ધૂંખલીનાથના “પદ્ધણ સે હંદ્દણ એદ માયા સે મિદ્દી”ના શાપ-અભિશ્પાદ્ય કાળની ગર્વાંના કાયમ માટે પોડી ગયાં હેવાની દંતક્યા પણ પ્રયત્નિત છે. વીરપુરમાં વિસોતની વીદી એને ‘વિસોતનું’ સ્થાનક આને પણ અરસીનું ધરાયે છે. જે એને આ રીતે સાંદળાં હોય તો ભૂમિકા છે ભરી। આપણે જેણો નામ છે તેનો નાશ છે એવા સામાન્ય અર્થમાં ‘પદ્ધણ સે હંદ્દણ’ને લઈએ છીએ, પરંતુ જૈન ધર્મનાં સર્વોમાં સૌથી મહત્વના ગણ્યાતા એવા કદ્યસુત્રની સુષેવિકા રીકાના દેખે એનો અર્થ એવો કર્યો છે કે જે સ્થાન પર જળ એને સ્થળ એવા જેને માગોથી પહોંચી શકાય. ડિશોરાલાલ ડાઢારીએ “સૌરાષ્ટ્રની વીસરાતી વાતો” ડાલમના વિચારોમાં એવું મંત્રવ્યક્તિ કર્યું છે કે આ જૂના નગરના કસાખાની જગ્યાએ એક મંહિર હતું, જે એને હ્યાત નથી.

વીરપરાનાથ પરથી વીરપુરનામ : મુલિખ થાણુણરોના સમયાં એ જનીનોટેસ્ટ રૂપી નાયદામાં આવ્યું હશે. આને પણ વીરપુરમાં મુખ્ય ભનનેમાં માનનાલાવ બાળુથી પ્રવેશતાં જમણ્યા હાંથી મરિયું આવેલી છે, જ્યારે તાણી બાળુ સામેના લાગમાં નાનક્કું ‘વીરપરાનાથનું’ દેશું છે. (ચિત્ર ૧)

“સૌરાષ્ટ્રના ધીતિહાસની વીસરાતી વાતો” માં શ્રી ડિશોરાલાલ ડાઢારી આગળ જણ્યાયે છે કે “પુરાણાજાના કૌલાંઠનગરતું” નામ વીરપરાનાથ નામના યોગીના નામ પરથી વીરપુર પદ્ધતું.” એનો એક સિદ્ધ વિભૂતિ હતા. ‘લોકુસ્તા’ના ‘કુસુ’ભલ રંગ’ની વિશેષપૂર્તિમાં શ્રી મનમુખલાલ સાતાના વિચારો મુજબ વીરપરાનાના રામણ મહિના પૂજારી હતા એને એમના નામ પરથી એમ કંઠી શકાય કે એવો નાયપથી હશે. નાયપથી શિવઉપાસક એને ખાખી સાંધુ રામઉપાસક હોય છે તેથી આ વાતને સમર્થન નથી ખાંગ શક્તું, માત્ર પાછળ આવતા ‘નાય’ શબ્દ પરથી અનુમાન કર્યું રહ્યું. કદાચ એમણે પાસે જ રામભહિરની સ્થાપના કરી હોય એને આને જ્યારામાયાના સ્થાનક્રમાં કાલાંતરે પ્રગતિ પામેલ હાલ નેવા મળતું રામભહિર એ હોઈ શકે. એક માત મુજબ નવ નાથ માહેના જ વીરપરાનાથ એક નાથ હતા. આ ભૂમિ ઉપર નાથસંપ્રદાયની પ્રથાલી મુજબ ધૂષ્ણ ધ્યાવનીને આરાધના આરંભી એને પણીથી એનો સિદ્ધ યોગી જની ગયા.

મીનાખલાવ અને સિદ્ધરાજનો જન્મ : વીરપુરની ૮૦૦-૯૦૦ વરસ જૂની અનિહાસિક મીનાખલાવ તથા સિદ્ધરાજ જયપદિનો જન્મ વીરપુરમાં થયો હેવાની માન્યતા વોરે બાઅતો આ વીરપરાનાથ સાથે જ સંકાયેલી છે. અનિહાસિક પુરાવાયો વગરની, પરંતુ “સિદ્ધરાજ જયપદિનો

પથિક]

એપ્રિલ/૧૯૬૩

[૧૧

जन्म वीरपुरमां थये होवानी हक्कतने समर्थन आपती विविध दंडक्याओं” मां “धीरजलाल साव-
लियाए थेडा प्रकाश पालेवो. अरेअर तो आ हक्कतनी तोष अने जहेरात थवा लेठाए अभ
अभे माने छे. वीरपुरना साहित्यकार श्री धूमेठेवीनी ‘सिद्धराज ज्यसिंह’ नववर्मां अमेवो आवो कोठ
जलतनो उद्देख कर्ये नथी, परंतु अश्वीलपुरथी सोमनाथनी भीनगडेवीनी थावा. हरम्यान वीरपुरमां
विराम देवातुं अने प्रस्तुतिसमय पाठी जवाथी वीरपुरनी भूमि उपर ज सिद्धराजनो जन्म थये
होवातुं निभित बिलुं थयुं ए वातने निःशंक गणवातुं शुद्धिगम्य लागे छे. श्री शंखप्रसाद हरप्रसाद
देसाईना “सौराष्ट्रो धीतिहास”मां (पा. २४८ पर) सिद्धराज ज्यसिंह रा’ नववर्षाना समयमां
सौराष्ट्रमां जन्में एटदुं ज्ञायावेल छे.

ज्वारामध्यापाना गुड, अभरेली पासेना फ्लेड्पुर गामना शीबोज्जरामध्यापा, नेझो
‘भोजनक्षत्रं ना छुलामध्या नामधी ओगापाता हता, तेमनी साथे संक्षारेली भीनगडेवीनी जन्मयुति
पालुं महात्मनी छे. आ जोनामगतना अतुरं चंह अने ‘भोज्ज-गुणातुवादना’ लेखक श्री लवण्य लगत
कोठापुक्कड याली आवती वात नेथी छे क भीनगडेवीने प्रसवकाणनो समय वीती ज्वा छतां प्रसव
न थां चिक्कुर पाठवुना महाराजन करवुदेवनां आ पाली भीनगडेवी रसाला साथे सोमनाथ महा-
देवना दर्शनार्थ नीकल्यां. रसालामां छालना वीरपुर तरीक ओगापाता ए विसेत पाठवामां पडाव
नापयो अने वीरपरानाथ नेवा सिद्ध योगी पासे पोतानी आ मुक्केवी रङ्गु करवातुं नजी थयुं. कहे छे
क अमेवो तपोयागी अतुं ताराण काढवुं के “करण्हेवनी शीज पल्लीने ‘भीनगडेवी’ने घेडे पुत्र अवतरे
तो ए गादीनो अने राज्यसंपत्तिनो वारस अने”. ए पसंद न हुं तेथी शोक्य तरीक डामधुक्करूप
करेलुं अने एक नैन सांखु दारा मंतेलुं पाशी शीशामां लरी शीशा जमीनमां दरावी हायो. होतो.
ज्यांसुधी आ शीशा जमीनमां धरणायेवो. रहे त्यांसुधी भीनगडेवीने प्रसव न थाय, तेथी तक्क
होडाव्यो अने पाठव बोडेसवारने भोडवीने राज उरुदेवना उरुपारमां अवा समाचार आपता के
भीनगडेवीने पुत्र जन्म थयो छे, तेथी तुरत ज आ जैन सांखु के जितिने शीज राशुओ ओवाव्या.
(पालनपुरना श्री नवाप अने जलीये जैन धर्मना पुस्तकमां आवा केटवाये भ्रयेगो दर्शन्या छे.)
आतुं अने ज नहि अवो जितिनो नवाप होवा छतां राशुओ भक्तम जह पडहतां आ जैन जितिये
पांचासरना दर्वाज पासे दाटेवा आ शीशाने पाँचा जितिने व्हारार काढवो. कचांक आ शीशाने अद्वे
घडानो उद्देख छे. अमा देहोने पूरी हती, पालु धडो आमेवा मोढावावो. ज ठो तेथी प्रसव न
ज थयो होय, छतां राशुना दुरायहथी जितिये ए ज्ञातुं, देहो व्हारार बिघातां ज वीरपुरमां
भीनगडेवीने पुत्रनो जन्म थयो कहेवाय छे. (सिद्धराजनो समय १०६४ थी ११४२ नो गण्याय छे.)

पोतानी हुःभयुक्ति थवाथी एक पुष्यकार्यद्वे भीनगडेवीये वीरपुरमां भीनगडाव अधावी,
संस्कृतमां राशु माटे वपरतो ‘देवी’ शण राशु भीनगडेवीने लायु पडे अने ‘भीनगडेवी’ अनी होय
अभ मानतुं रख्यु. आजे पालु भीनगडावना एक गवाक्षमा पोताना पुत्रने स्तनपान करवती भीनग-
डेवीनी भूतिर्नुं शिव्य कंडारायेलुं नजरे पडे छे. आ सिद्धराज अनां पापो क्षेत्रे करण्हे निःसंतान
गुजरी गयो. (वित्र २)

श्री धीरजलाल सावलियाए ज्ञातुं छे ए मुजाय हो ज्वाल अगत होइ वार्ना थया त्यारे
अभमा खो गृहसामी अत्यंत वेदना थवा लागी तेथी अभमां भाता गंगायाईये भीनगडेवीनी
मानता करी. गूम्हुं उमार्ह ज्यां वीरपुर आवी भीनगडेवीने श्रीकृष्ण वधेयुं” त्यारे न देवायेली अभमा

वाणी नें व पछीथी साची पड़ी। “ते सारु” एक श्रीदण्ड लीडू छे, पालु हुं तारे आठेथी भयां श्रीदण्ड लर्हि लर्हिस”. तदनुसार पोताना शिष्य ज्वारामापाचे सदामत शहर कर्हुं अने यात्राणु श्रद्धागुण्या तां श्रीदण्ड पक्कारे छे; जोडे सिद्धराजना जन्मस्थल विशे पालनपुर धांधलपुर ज्ञानांग वज्रेना उल्लेखे अने दावा पालु धतिहासना पाने नेवा भये छे. दा.त. ‘भेरुतंग’ मुख्य उत्तर युन्नरातना पालनपुरमां सिद्धराजनो जन्म थेबे होवातुं श्री सावित्रियाचे ज्योतिष विशेष आनी सामे डेटवाकुनो तक्क अवो छे के अने नामेने छेडे ‘पुर’ शब्द अवतो होवाया कहाय वीरपुरने अहंवे पालनपुर थर्ह गयुं होरे!! आम अतां सुरेन्द्रनगर निवासना सायदा तालुकाना धांधलपुर के धांधलपुरमां पुत्रजन्मनी स्मृतिमां हुर्हा वाव राजमहल वज्रे व वंचाया होवातुं सायुं भानीये तो वीरपुरमां पालु भीनगवाव आवी ज स्मृतिमां आंधी होय अमां शी शंका? वली वीरपुर इरतो पालु डाट (गढ) होतो ज, ने आम पंचायते तोटीने लालु पत्ती ज्ञानेव विशेष पालु छे.

भीनगवावतुं जहरी जतन : ‘यात्रा सौराष्ट्रना प्राचीन अवशेषोनी’ वेभमां श्री भिन्निलाई वोराए दशांव्युं छे के “पोरं दर्शनी उत्तरे आह दि. भी. परे हुं छी गामधी यारेक दि. भी. कांतेला गामधमा वायेवा समयना भंहिर अने कुंड छे.” अवी ज वीरपुरनी आ सोलाङ्गी समयनी वाव छे. भीनगवाव भरामत पाम्या वगरनी भूतिंग्यावाणी वाव छे. ‘आप्युं प्राचीन विश्वान’ शोषक फेळा श्री होलत अहे वापी-शिविनी तस्वीर साथे वर्चा करीने ज्ञानांव्युं छे के “वाव हुवा तगाव कुंडो समृद्ध ज्ञविनाना भेषता प्राचीन मुरावाओ छे.”

कडचन घेणावीरा घातेना उत्तमनां धरुपीय संरुक्तिना पुरावाद्य अवशेषो भल्या छे. पांच हजार वर्षों पूर्वे पालु कडचनां वाणी तंगी दर्शवतां, पाणी संवरवानां जगाशेषो हतां. भानुक-ओना अग्न नमूनाओना साथे तां आप्युं धुऱ्युं भगो आप्युं छे. वीरपुरनी भीनगवावतुं शिल्प लगभग नाश पाप्युं छे. प्रतिमाओ भोटा भागनी नाप थर्ह छे, डेटवाक गवाक्षे आवी पडवा छे, शिल्प उडावाई गयां छे. पुरातत्व आतानी संतोषकारक जगवाली न होवानी अने भीनगवावनी सुरक्षा अंगे वषु व्यवस्थानी जहर होवानी रजूआत आ लेखके ता. १४-३-६२ ना रोज वीरपुर मुक्तमे आवेला शहेरी विकास भंशीशी नरकरि अभीनोने करेली, इरीथी ता. २-४-६२ ना रोज समृद्धिपन लमेल. ४-७-६२ ना रोज राजकौटमां पुरातत्वविद अधीक्षक श्री वाय. एम. शीतगवावाने अने संयुक्त भाडिती नियामके इतके भगाने रजूआत की तथा १० मुद्दाओवाणुं आवेनपन आपेक्ष. अभीना १३-७-६२ ना पत्र-क्रमांक ३६१ मुल्यां भीनगवावनी हुरस्ती माटे सरकारशेषे हा. हा हजारनी २८८ फूली छे. अभीना मत सुरक्ष वीरपुर आम पंचायतनो सहकार भगतो नवी, वज्रेना अनुसंधाने ता. ३१-७-६२ ना रोज ६ मुद्दाओनो पत्र आ लेखक वीरपुर आमपंचायतने पालु घाठेव छे. (आज सुधी पालु ज्वाल नवी.) कांतेलानी इत्याने साडा त्रष्ण कि.भी. ५२ केटवा. एव्यावसावेलुं श्रीनगर गाम छे त्याची उत्तरे होसे कि.भी. ५२ केटवा. एव्यावसावेलुं श्रीनगर गाम लोन आवायतो नवी, वज्रेना सिद्धनाथ-रणछोडाराय-पहराणीं भंहिर ज्ञानवाव वज्रे धर्मस्थाने आवेलां छे; दानवीर स्व. श्री नानालु कलिहास भहेतांगे योताना अयो आ अधानो ज्ञानोक्तार करावेल छे. अजंता ध्वेतानी युश्मेनी जगवाली तेम विकासने लगती एक योजनामां केंद्र सरकार आणग वधी रही छे; १६४/११ करोडानी आ योजनामां ज्ञानस्थित एक संस्थाने थोडा फोला. आयो छे. आ संस्था इ. ७५/५४ करोडानी लोन आपरी, ज्यारे केंद्र सरकार इ. ३२/८८ करोडानो अर्य करवानी छे. “ज्ञानगरमां शिवहरि दावर्सना प्रम्बे भयु. कमिस्नर रोग घोक्तमां” आवा समाचार.

आपां गुजराते वांच्या हो. त्यांना भूजियो कोडो तेम अंभाजिया नाका वजेरीनी मुखाक्षत वर्खते आपणा राज्यना राज्यपाल श्री मेहदी नवाजे पण पुरातत्वरक्षित आ स्मारकोंसां रस लीपा होते. अगांविनी सौराष्ट्र सरकारे १४५६ना जन्युआरीमां अहार पांडेला जेडेनामामां नमनगर जिल्हामां पुरातत्वनी दफ्टिके ३५ स्थानेने आरक्षित नांदेर करवामां आवेलां. सौराष्ट्रानं कुच आवां १८६ रक्षित स्मारकों नांदेर करायां छे अने २४-७-१९७२ थी भीनणवावने पण पुरातत्वरक्षित स्मारक तरीके नांदेर कराई छे. सरकार कोई श्रमांत दुङ्गंभनी आर्थिक सहायानां अने लोकान्युति तथा रक्षित जुवानो माटे फाणयेवां नाला. योअ रोटे वपराय अे लेवानो संतर्कता ७ आवां स्मारकोंने व्यावी शक्ती. जूनागढ उपरकोटीमां आवेला अटीक्कीवाव नोंदाखूद्दोये. जुबामरिजन औद्योगिकांना लेवां प्राचीन स्मारकोंना अण्णोंद्दार पाण्या सेवाकावी संस्थांच्या प्रशासन प्रणालीय प्रतिनिविष्येनी संसुक्त समिति दारा मुजरात पुरातत्व आता अने भारतीय पुरातत्व सर्वेक्षणाना सहयोगयी प्रथम तपश्चाता १४५ हजारनो अर्थर्थी थवानो छे. आ समाचार लाखी थोडा आनांद अने मानसिक आश्वासन मधे अरां. चोलीवाथी १४ कि. भी. दूर आवेला पुरातत्वप्रसिद्ध जरिया महादेवना भाविरमां गुजरातां आवेल शिवलिंगं अने उपरकी थवो प्राइटिक संतत अवो जल-अभिषेक पण आवा जतनानी राह जेतां स्मारकोंनुं दृष्टांत छे. रक्षित स्मारकोंनी यादीमां सरकारशीर्हे अने सर्वेणा सामेल करी देवुं ठोक्के.

भीनणवावमां हुतुमानल्लनी प्रतिभाः : प्रांगंगी तातुकानी कसियावाव, जूनागढ तातुकानी चोलीवाव, अडाळजनी वाव, दाढाडीरनी वाव, लेडी भूजग्नी वाव, भातरक्षवानीनी वाव, उत्तर गुजरातानी पाटखनी महाराष्ट्री उद्यमानानी वाव वजेरीनी डोरेणां ७ वीरपुरनीआ ४८ परचिवावाणी भीनणवाव स्थान पामे अवी छे. उद्यमितीनी वावमां लेम हुतुमानल्लनी भूर्ती डोवानो विरक नम्हो छे तेवुं ७ भीनणवावनी भायतमां पण छे. तां पण वावमां प्रथम भंउपामां ७ प्रवेशतां हुतुमानल्लनुं शिव दृष्टिग्रायर थाय छे. कठाच अम पण अन्युं हेय के राज भीमदेव पहेलाना पट्टराष्ट्री उद्यमिती भानग्नीलाना लग्नमां भूर्य ४ जेभारानो लाग लज्जावाते राजकुडुं अनी संर्वावत जीवावायावने नामशेय अनानी हांधी हती, अमना गुणोभांधी प्रेरणा लठीने ७ खुद भीनणहेवीये पणु सिंहराज जयसिंहना शासनमां रिघरता रथापी हती अने ए ७ परिपाटीमां वीरपक्षनाथानी अपेक्षा मुजर्य अंधी आवेली वावमां उद्यमितीवावनी माझेक ७ हुतुमाननी भूर्ती प्रस्थापित करी हेय. (चित्र ३)

भीनणवावमां चार भंउपाना भारोटो पर ऊळवटलखुं शिव कंडारायेलुं छे. वावनी संस्कृतिनो वांटों न वाणी भाय अनी भास तडेदी लावने तज्ज्ञे कवरी छे. पाण्यापुरवठा ओर्ड वाव संबाला ले तेपण भक्तवती कामगीरी थर्ट गणवारो. पाण्याना स्तोत्रुं पण अेक अगत्युं साधन आ भीनणवाव छे. प्रवेशतां हुतुमानाना गवाक्षी नीवेना लाग तरइ जतां ए चाली वटाव्या आह सिंहराजने रतनपान करावती भीनणहेवीना शिव विशे कोई गोतानां इमभा-जोदीयी पणियां वाणीने अनी २० (धूग) ए चेलीमां लरीने अहार लावे तो रतनभांधी धावणु न आवतुं हेय तो धावणुनी धार कूटे एवी प्रयतित भान्यताथी प्रेराईने सेंडो खीलो. हर वरसे आवी मानता करै छे.

अन्य भाविरो, समाधिस्थानो वजेरे : उपरात पालीताल्याना युवराज श्रीमानसिंहल्लमे अंधावेल १०१ वरसे जूतुं मानकेखर महादेवतुं भावित पण भीनणवाव पासे ७ आवेलुं छे. (चित्र ४) मानसिंहल्ल सूरज ठाकोरना भाषेज हता तेथी वीरपुर रहेता.

तहुपरांत गंगेखर महादेवतुं भावित गामना जोहर जलाराम आपानी समाधि पासे आवेलुं छे. जलाराम आपानां पली वीराष्ट्रीमानी साझेने सोंपश्ची, जोणी-थेकाना परव्यानी वात वजेरे ने स्थगे

અની ત્રિવેણુશ્વર મહાદેવતું ભાઈ ગામથી બહાર ચારેક ડિ. મી. હર છે, જ્યારે ‘સંખ્યાવાઈ’ તરીકે ઓળખાતી જગ પર ઉદ્ઘાસિયાપુણે સ્થાપેલી પૂરા કંઈની હતુમાનમૂર્તિ ધ્યાનાર્થેક અની રહે છે; કેરાઉશ્વરથી કેરાળી પંથક, ધ્યાપરવાતી પાસેના પૂરા કંઈની હતુમાનની મૂર્તિ, પાંડેવાતી ભૂમિ વગેરે સાથે આ સંખ્યવાતીના હતુમાનની મૂર્તિનું અનુસંધાન જણાય છે. (ચિત્ર ૫) આ સંખ્યવાતીના હતુમાનની પ્રતિમા રૂ' ના વેરાવાનાં ૬'-૮" ની ભાંચાઈ ધરાવે છે.

જ્યાદારમયાપના વિશ્વવિભાગાત મંહિરની સાથે ગામથાર ‘સંખ્યાગ’ તરીકે ઓળખાતા વિસ્તારથી આવેલું હતુમાનમંહિર અને એલાયાર માતાનો ધરો તથા મંહિર વીરપુર એસ. ટી. ડેપોની સામેના રસ્તે આવેલ છે, તે રૈલવે સ્ટેશન નજીક ભૂષેશ્વર મહાદેવમંહિર અને શીતળામા નાગધાઢા વગેરેનાં સ્થાનદા આવેલો છે. ગામની અંદરના લાગમાં ધૂમકેતુમાર્ગ પર સ્વામિનારામયુ-મંહિર, ઝૂખ્યમંદિર-હલેવી, ગામની મધ્યમાં ટાવરચોડમાં નીલકંડ મહાદેવતું અને રામતું ભાઈ આવેલ છે, જે સ્થાન ગામના યોરા તરીકે જ ઓળખાય છે. ચોરાથી આપાની સમાધિ તરફ જતાં હતુમાનનેરી અને સમાધિથી ગામ બહારના રસ્તે સતીમાની ડેરી વગેરે ધર્મસ્થાનો છે. એલાયાનો પાઠ, હેંડ્રો, બિહામણીનો પુલ વગેરેતું વર્ણન ધૂમકેતું ‘જીવનપદ’ (પા. ૪૩) માં કર્યું છે અને જણાયું છે કે ‘દેરેક ગામને પોતાનાં યોરાર કાંચયમય સ્થળો હોય છે. આ રમણીય સ્થાનોની પિછાન કેટલી રઘુઓને અને રણારીને હોય છે તેટાં બીજા કોઈને હોતી નથી.’

વીરપુરાં આ બિહામણીના પુલ અને તળાવ વિશે આ લેખકને શ્રી મનુલાઈ જાની તરફથી ભગેલ વિભિન્ન નોંધ મુજબ એતું મૂળ નામ ‘હામોરસાગર’ હતું અને એટીને રાજીવ દારા એમાંથી પાણી પરું પડાતું. સિંચાઈની સગવડ પૂરી પાડતી આ પાણીની પાઠને ‘હેમદ્રો’ એટથે કે ‘હેમધરો’ એતું નામ મળ્યું. એતી માટે એ સેનાનું પકડતો ધરો હતો. આ હેમદ્રાને કાંઈ આવેલો કૂચો ‘જિલ્લાના નામે આને એલાયાય છે, કેના ઉપર ૧૫ હાર્સ-પાવરતું એચ્કલ એન્જિન મુજબને સિંચાઈ નાટે પાણી કૃવાની બહાર કટાતું. ધૂમકેતુંએ જણાયું છે કે લોકોએ તે હેમદ્રાની જ્યુતપણ આ રીતની શાખી હતી. કોઈ હઠયોગી સાખુની એમાં મુદ્રા પડી ગઈ. એમણે તાં આસત જમાવાને ‘હે મુદ્રા! હે મુદ્રા!’ જ્યા જ્યેણો તેમાંથી ‘હેમદ્રો’ થઈ ગયું. બાકુ તો હેમદ્રો એ ‘હેમપરા’ (સં. હિમહુદ પ્રા. હિમદહ) પરથી જ નિષ્પન્ન થ્યેલ શાખ હો. કાળા ઉનાળામાં પણ તાં કંઈ દિમ એતું પાણી હિલોગા લેવેં હતું. કુલ્લું માં રાજકોટ જિલ્લાની આદાય આમણ્યાયત અને આમ રાજના એક આદર્શ નમતા તરીકે વીરપુરી આમણ્યાયતે ગૌરવાની સ્થાન એ વધીનું મેળવેલું હતું, તો તાનેતરમાં જ જુલાઈ ૬૨'માં સુંભાઈંના અવસાન પામનાર ૭૧ વર્ષના શ્રી એસ. એ. રાજકેવ વીરપુરના વતીરી હતા તેમણે દિક્ષમ નિર્ભાષ્યકેતે વીરપુરને આગળ કર્યું હતું. એમના પિતા વીરપુર રાજના કાંચાલારી હતા. દિક્ષી દિક્ષો જ જંગલકાળ જાહુ, જંગલકવાન, જયચિતોડ, એલિફન્ટકીની, ઈંસાદ, રાત અંધેરી થા, અન્નામ, તુસાન, એહસાન વગેરે (લેવી દિલો) એમણે નિર્ભાષ્ય કરેલ, તો ગુજરાતી દિલોનાં સતી અનસ્યા, ચૂંદીને રંગ, અમા મારી એનદી વગેરે પણ એમણે અનાતને સર્જણતા મેળવેલી.

વીરપુરનો પર્તમાન અને ભાતી વિકાસ: આને વીરપુર એક ધર્મધમતું નગર જની ગણું છે. કુલ ૩૧૭ ખસે દિવસ ફરમાન અવરજનર કરે છે. ચાર પ્રાચીવેટ ટ્રૂવેલ્સ કર્મયની, ૩૮ ટેક્સી ગારી અને ૪૮ રિક્સા આ ગામમાં હોય છે. ૪૫૦ નગાનેકશનો ગામમાં છે. લાઇફી, શાકમાર્કેટ, પંચાયત-સંચાલિત અને ટ્રૂસ્ટ-સંચાલિત સ્કૂલો, આલામંદિર, સરકારી દ્વાખાતું, મીલ સ્કૂલ,

હાઈસ્કૂલ, પશુ-વાખાનું, ચાર ખાનગી હવાખાનાં, ગેરટ અને ટેલિગ્રાફ ઓફિસ, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, સહકારી મંડળી, સહકારી એન્ક્રીપ્શન એન્ક્રીપ્શન, ઓફિસાલ, એ ખાનગી ટ્રૂટ, સિની સર્વે ઓફિસ, પ્રવાસ અને માહિતી ઘાતાની ઓફિસ તથા જમીન વિકાસ એન્ક્રીપ્શન. નિયમ અને વિષ એન્ક્રીપ્શન સહાયથી પાસે આવેલા હાગવહ ગામને પાંચ વરસ સુધી હત્તક લાયિલ છે. ગામમાં કુલ ૧૪૮૮ મોઠાં છે. ગામની કુલ સીમજનીન ૬૦૭૮/૩૮ એકર છે. જ્યારે જોયર ૮૭/૧૬ એકર છે. ગામમાં ૫૨૬ આતેદાં મેડૂટ અને ડેપ સીમાંત મેડૂટ છે. ૨૧૦ વૈટાંબકરા સાથે કુલ ૨૮૦૦ પશુઓ છે. એતિમાં ૬ ટૂંકૃત અને ૨૨૫ ઓફિલ એન્ક્રીપ્શન વપરાપ છે. ૫ ચાયત હુસ્તકમાં ૭ કૂવા અને ૮ ડાઢીઓ છે. ૫ સભમસ્તિંબલ પંચ છે અને ગામમાં શોલા વધારતા ૪ સોલિમ બ્રેમ છે, ૫ છણવાની ધંડી છે. આમ દરેક રીતે વારપુર અનિ ગ્રાતિશીળ છે. (આ સત્તાવાર માહિતી મામસેવક જગત્કાવનાનાઈ વધાસિયા પાસેથી મેળાની છે.)

આગામી દુંકે સમયમાં નગર પંચાયત મેળવવાના પ્રયત્નો કરવાનો તથકો આવી થિયે છે. રાજકીય દશ્બિંદુ સમગ્ર જેતખૂર તાલુકામાં વીરપુર મોખ્યારે છે, ગમધંનું રાજકારણ રંગાલું, અપેરંગી, લલબલાને ડાનાવી હે અને ગણડાની પથ મુકે તેવું વિલક્ષણ છે. રાજકારણને નિરંતરીકર નફરત કરનારા અને રાજકારણને નરકાગાર ગણ્યતા કેટલાક લોડો કથારે રાજકારણમાં આવી હોય અને આવી હોય એ વિશે કંઈ કંઈ ન શકાય. રાજય અને રાષ્ટ્ર કક્ષાના નેતાઓ દ્વારાને અને ચૂંટણીના નેલ હેઠાં વીરપુર આવતા હોય છે. સ્થળના અભાવે અને હુકાનોને મેલ દ્વારાની આસપાસની અતિ લોચીય પાદહોને કારણે નાના મધ્યમ માધ્યમસ વીરપુરમાં રોજ રણ શકે એવું હોય નથી રહ્યું. ટ્રાફિકનો પ્રેમ માધ્યમે હુકાયો થઈ ગયો છે, કારણ કે દરરોજનાં એણામાં એણા એક હંજર યાત્રાણુંની અવરલયર રહે છે. ગેરટ હાજિસ્ટાલામાં એકે-એ અપવાહ સિવિય લાય લાવો સેવાના હોવાની વાતનાં વચ્ચે છે. યાત્રાધામ સાથે આ ખંડાં સંકળાયેલાં અનિવાર્ય અનિષ્ટો છે, તો થરવીરતા કરેલી કેટલીક ધટનાઓ પણ નોંધપાત્ર છે. દાત. અહારવિદ્યા રામવાણાના છાપા વધતે ગામના ગોકળ જશમત ડેરિયાએ એવો મંજુમ સુક્રાયદો કરેલો કે આંદો કાંદોનો સ્તરન્ધ અની ગેલે. તાનેતરમાં લોારી તાલુકાના દુંહલા ગામની સીમામાં કોઈ બોલાઈએ એક જ આટકે લુંગારા ઘિતાની જીલ જોચી કીધાના સમાચાર હતા. વીરપુરના કાંદોરે દીપાદાનો ઘિકાર કરેલો એ ભાગતની ચર્ચા આપ્યા ધલાકામાં થતી હતી. આ છે વીરપુરની ભાતીગળ મેલમાં !! કોઈ અર્થસંપન્ત માલાખસ વીરપુરને રાજગારીતું બેન્-કારખાતું ઉદ્ઘોગ, આર્થિક સંકુલ વગેરે પૂરું પાઢી શકે તો જ વીરપુરનો આર્થિક વિકાસ સંસ્કૃતિક વિકાસ સાથે ઇથી કરી શકો અને જુવાન પેઢીના શારીરિક તથા બૌધ્ધિક સ્તરને સન્માર્ગવાળા શકાશે. 'મહ્સુ' દે. ૮/૮૮, આનંદનગર, રાજકોટ-૩૬૦ ૦૦૨

સંદર્ભ સાહિત્ય-અંગ્રેની સંગ્રહ

- (I) The Bhadarkantha Directory, (Mahi) Vol. I, Complied by Khan Bahadur Framroz Sorabji Master.
- (ii) Gazetteer Bombay Presidency, Vol. V.
- (iii) Administrative Report of Rajkot District, 1960-67
- (IV) "Geography of Towns", A Smailes.
- (V) Western India State Agency Civil list, 1940

- (vi) History of Kathiawar, Wilberforce
 (vii) History of Gujarat, Hiralal Parekh.
 (8) Census Hand book of Rajkot District.
 (9) 'કાલિયાદા', નમ્બરાંકર લાભશાંકર (કર્ણાં વોટસન સાહેબ).
 (10) 'સૌરાષ્ટ્રનો ધતિહાસ', શાંકુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ, પ્રકાશન સોઝર શિક્ષણ અને સંસ્કૃતિ સંધ, જૂનાગઢ (પા. ૨૫૭, સિદ્ધરાજ તેનાં પાણી કર્માંના કાર્યો મિસાંતાન ચુનવી ગયો.)
 (11) 'બહેનો ધતિહાસ', રાજવૈદ અવરામ કાલિહાસ શાખી (શ્રી યરથુતીર્થજી મહારાજ, ગોઝળ)
 (12) 'ધૂર્ઘંશપ્રકાશ', શ્રી આવદાનજી.
 (13) 'વીરપુરની અસ્તિત્વા', શ્રી નરેશ શાં. જેણી, નીલકંઠ પ્રકાશન, નીરબકુમાર એન. જેણી.
 (14) 'ઉત્સવ', માર્ય ૮૬, તંત્રી, સૌરાશ શાહ, પ્રકાશક જગદીશ ટેક્નોલોજી, સુરત.
 (જલારામ આપાના વીરપુરની અદ્ધાયાત્રા) નરેશ શાહ, ૧૪/૨ કાલિહાસ મિલ ફ્રેન્ડ્સ, જોગપુરા, અમદાવાદ.
 (15) 'ગુજરાત દોષોત્ત્વની અંક', ૨૦૩૩ 'યાત્રા સૌરાષ્ટ્રના પ્રાચીન અવરોધેની', મણિબાઈ વોરા,
 દિ. સ. (૧૯૭૭), તસ્વીરો શ્રી નરેશમલાઈ પલાણ.
 (16) વિવાદ, 'સિદ્ધરાજ જ્યસિંહનો જન્મ વીરપુરમાં થયો હતો?' ધીરજલાલ સાવલિયા,
 ૩૧-૧૭-'૬૨ લોકસત્તા.
 (17) સોલાંફુરાણ સિદ્ધરાજ જ્યસિંહનો જન્મ વીરપુરની પવિત્ર ભૂમિ પર થયો હતો. મનસુખલાલ
 સાતા, ૧૦-૭-'૬૧ લોકસત્તા વિરોધ પૂર્તિ, 'કસુંઅલરંગ.'
 (18) 'સૌરાષ્ટ્રનો ધતિહાસની વીસરાતી વાતો', ડિશોરલાલ કોઠારી, 'કૂદાથ', ૨૩-૧૦-'૬૬
 (પુરાણકણના કૌલાંડનગરનું નામ વીરપરાનાથ નામના સિદ્ધયોગીના નામ પરથી 'વીરપુર'
 નામ પણું?)
 (19) 'સૌરાષ્ટ્રની વીસરાતી વાતો', ડિશોરલાલ કોઠારી, 'લોકસત્તા' ૨૮-૫-'૮૩
 કાં જલા ને કાં અલા, વીરપુરા-વીરપુર.
 (20) 'હેમદ્રા' પરની વીરપુરના શ્રી મનુષાઈ સ્ને. જાનની નોંધ.
 (21) આમસેવક શ્રી જગળુણનભાઈ વધાસિયાની ઇન્ડિ મુલાકાતો.
 (22) 'સ્વ. રડાભાપો' (શ્રી જવારામભાપાના તકાલીન સંપાદ) ને મોકે સાંભળેલી નાનપણની વાતાંચે,
 (23) તસ્વીર, શ્રી મુકેશકુમાર ડી. ગાળ્યુરા, સહયોગ શ્રી રમેશભાઈ વી. ગઢિયા.
 (24) 'વીરપુર ગામ જલારામ લક્નાના નામે ઓળખાય છે. 'અંકિલા' શ્રી તુલસીહાસ પિટાલિયા, જલનગર
 (25) 'પ્રાચીન યુગનો ઘ્યાસ આપતી વીરપુરની મીનળવાં', 'જ્યલિંદ' ૨૬-૧૨-'૭૪
 (26) 'આપણું પ્રાચીન વિજાન', 'ગુજરાત સમાચાર', દેસત ભદ્ર, વાપી શીર્ષ્ય ૧૮૩૪-મહિના.
 (27) 'વીરપુર મારુ ગામ', પ્રા. ચંદ્રકાન્ત એચ. જેણી, 'ગુજરાત સમાચાર' ૧૨-૧૧-'૭૬
 (28) 'લોકસત્તા'-૧૮-૩-'૬૨, પ્રવાસી પ્રતિનિધિ કચ્છના વોગાવીરા ખાતેના ઉત્સવમાં હડપીય
 સંસ્કૃતિના બધું પુરાવા મળ્યા.

(29) કેટલીક અભયારી ચર્ચાઓ :

(1) 'ભીનગવાવતુ' ખંડેર રક્ષણ માગે છે, કથા ગિરિધરલાલ ઠકર, તસીર વિનય બોજાણ્ણી.
'કુલભાઈ' ૨૫-૩-'૮૩

(2) 'પુરાતત્વ આત્મા દ્વારા ઐતિહાસિક સ્થળોની જગ્યાથી થતી નથી.' 'લોકસત્તા', તા. ૮-૧૨-'૯૨

(3) 'ભીનગવાવ રદ્ધિત સ્મારક જાહેર થઈ છે.-નાયથ માહિતી નિયામક, રાજકોટ 'કુલભાઈ',
તા. ૮-૪-'૯૩

(30) 'ફોન્સ' સાહેબની સંડક્ષિત દંતકથાઓ' (31) 'ભારત કે પ્રાચીન રાજ્યશાસ્ત્ર', ભાગ ૧

(32) સ્વ. જૂહાઆપા દિલાણી, પાસેથી નાનપણમાં સંભળેલી વાતોનો આખાર.

સ્વ. ભૂરાઆપા ચંદ્રાલા, સ્વ. મેહનાયાપા સુધૂર વગેરે વૃદ્ધજનો.

(33) ૨૫-૭-'૯૨ આકાશવાણી પરથી પ્રસારિત ચેવેલ 'ધૂમકેતુ ક્રીજ', પ્રો. ચંદ્રકંત એચ. નોષી

(34) 'અધિક્ષક પુરાતત્વવિદ, વાય. એમ. ચીદતવાલાનો મારા પરનો તા. ૧૩-૭-૯૨નો પત્ર', ન'. ૩૬૧

અનુસંધાન પા. ૪ થી]

રાખરથી કંથકોટની મુલાકાત લીધેલ. કંથકોટ દુર્ગાનું સ્થાન કંચળના ધર્તિહાસમાં અનેક છે. અનેક જાહેરલાલી ચર્ચાની પદ્ધતિ તથા ધર્તિહાસની કરવણો બદલતી જોનાર આ દુર્ગાની આજની હાલત જોઈ કોઈ પણ ધર્તિહાસપ્રેમીનું મન જિન થઈ લય. શુભરાતના પુરાતત્વ આત્માએ ત્યાં રદ્ધિત સ્મારકનું એરો લગાવા સિવાય કંઈ કર્યું હેચ્ય એવે જગ્યાનું નથી. ખરેખર તો આવાં સ્થાનોની યોગ્ય જગ્યાથી થાય તો જ આજની પેહી આપણા લય ધર્તિહાસ વિશે જાણું થાય એવી ભાવના કંચ ધર્તિહાસ પરિષદના સભ્યોએ વ્યક્તા કરી હતી. કંથકોટ વિશે તમામ જાણુકારી શ્રી ટપુભા ગઢવીએ આપી હતી. સમય કાર્યક્રમને સફળ અનાવવા કુ. ઉમર્મિલા ઠકર, શ્રીમતી મંગલાબહેન, શ્રી નેષસી મીડિયા, શાન્તિલાલ વડુ, શ્રી અણ્ણુલ જુમાણી, ગફૂર જમાદાર વગેરેનો જન્મત ડાંડી હતી.

દેણાવીરા ઉત્તમનન ક્ષેત્રના સર્વાંગી પટેલ રાત શર્માંએ પણ ઉપરોગી માહિતી આપી હતી. આમ જાનસત્તન સાથે સાથે કંચળના પૌરાણિક સ્થળોની મુલાકાતનો લાલ પણ પરિષદના સભ્યોએ લીધેલ હતો.

મંત્રી, કંચ તિહાસ પરિષદ, ભૂજ

ધી ખરેડા સીટી કો-એસેપરેટિવ બેન્ક, લિ.

રજિ. આફિસ : સંસ્થાવસાહી, રાવપુરા, વડોદરા-૩૬૦૦૦૧

શાખાઓ : ૧. સરદારલાલનાનાકા ભાગ પાસે

૨. ખથથરેટ પાસે

૩. હૃતેખંગ ચર્ચ સામે

૪. સરદાર છાગ્રાલય-કારેક્લીભાગ

૫. બોરવા જાહેરનાકા પાસે

૬. આર. વી. કેસાઈ રોડ

૭. જોગી રોડ

દરેક પ્રસારનું એન્ટિકાર્સ કામરાજ કરવામાં આવે છે.

મનેજર : કાંતિલાઈ ડી. પટેલ

મંત્રી : ચંદ્રકંતલાઈ ચુ. પટેલ

પ્રમુખ : કીંકાલાઈ પટેલ

એમિલ/૧૬૬૨

[૫૬૬૫]

કાઠિયાવાડ રાજકીય પરિષદની કામગીરી અને એનું મૂલ્યાંકન*

ગ્રા. કદ્યપનાભહેણ એ. માણેક

સ્વતંત્રતા પહેલાં 'કાઠિયાવાડ' તરીકે જોગખાતો સૌરાષ્ટ્રનો પ્રદેશ એ રૂરુ રાજ્યોથી¹, લગભગ ૨૨,૦૦૦ ચોરસ માધિકનો વિસ્તાર અને લગભગ ૩૬ લાખના વસતી ધરાવતો હતો.² આ પ્રદેશમાં આવેલાં દેશી રાજ્યો એ પ્રતિક્રિયાવાહના ગઢ-સમાન હતાં અને રાજ્યિક ચણવળને ઘફાલરી નજરે જોતાં હતાં,³ તો શ્રી ઉ. ન. હેયરે આ રાજ્યોને ફામામ શોષણ અને ખરપણી ખાંચ ગણ્યાયો હતાં.⁴

૨૦ મી સીના આરંભે શુન્નતાના ખિટિશ શાસન હેઠળના પ્રદેશમાં રાજકીય જગૃતિ આવી ગઈ હતી, પરંતુ સૌરાષ્ટ્રમાં રાજ્યિક ચેતનાનો સંચાર ધીમી જગત્તે થઈ રહ્યો હતો.⁵ એનું મુખ્ય કારણ એ હતું કે સૌરાષ્ટ્રમાં રાજકોટ ભાવનગર જેવાં રાજ્યોને ખાડ કરતાં અન્ય દેશી રાજ્યોમાં ભન્નરાચાહી અને આપણુંચાહી પ્રવર્તતીની હતી. રાજ્યકટાંચા પ્રન પાસેથી કરવેરાના રૂપમાં મેળવેલાં નાણને ઉપયોગ જવાયારાની કોઈ કાવના વિના અવિચારી ખર્ચ પાછળ કરતા હતા.⁶ સૌરાષ્ટ્રના રાજ્યોની પ્રન કાંતિકારી કે રાજ્યિક પ્રદૂતિમાં ભાગ લઈ શકતી ન હતી છતાં એનો રાજ્યિક વિચાર ધરવતું સાહિત્ય ક્ષેપી રીતે મેળવીને વાંચતી હતી.

ખિટિશ હિંદુમાં રાજ્યિક પ્રદૂતિના વિકાસની સાથે સૌરાષ્ટ્રની પ્રનમાં પણ ધીમી જગત્તે રાજ્યિક ચેતના આવી રહી હતી. સમયની હવા પારખી લઈને શુન્નતાનાં ડેટલાંક દેશી રાજ્યોએ પ્રન-પરિષદ કે પ્રન-મંડળ યા પ્રન-પ્રતિનિધિ જેવી સંસ્થાઓ સ્થાપી હતી. શુન્નતાનો સૌંપ્રથમ વહેદારા રાજ્યે ૧૯૧૬માં અને પછીથી ભાવનગર રાજ્યે પ્રનપ્રતિનિધિ સભાની રચનાની ૧૯૧૭માં જાહેરાત કરી હતી. સૌરાષ્ટ્રમાં આ પ્રકારની આ પ્રથમ સંસ્થા હતી.⁷ જામનગર રાજ્યમાં પણ ૧૯૧૮માં સલાહકારી કાઉન્સિલ રચનામાં આવી હતી. રાજકોટમાં ૧૯૨૩માં પ્રનપ્રતિનિધિ સભાની સ્થાપના કરવામાં આવી હતી.

આમ, સૌરાષ્ટ્રનાં ડેટલાંક રાજ્યોમાં પ્રનના પ્રશ્નોને વાચા આપવા માટેની સંસ્થાઓ સ્થપાઈ હતી, પરંતુ સમસ્ત સૌરાષ્ટ્રનાં અધ્યાત્મા રાજ્યોમાં વસતી પ્રનના પ્રશ્નોને વાચા આપવાના કોઈ દેંદ્રીય સંસ્થા ન હતી તેથી આવી એક સંસ્થા મુંબઈમાં ૧૯૧૭માં મનસુખભાઈ રવળ મહેતાએ 'કુચ્છ-કાઠિયાવાડ એસોસિએશન' નામની શર કરી હતી. મનસુખભાઈ મહેતા દેશી રાજ્યોને લગત પ્રશ્નોમાં નિષ્ણાત ગણ્યાતા હતા. એમણે ગાંધીજીને આ સંસ્થામાં જોખાવા લખેલું ત્યારે ગાંધીજીએ એમાં જોખાવાની અનિવાચિત દર્શાવી હતી તેથી આ સંસ્થા જીગતાં જ અથભી ગઈ,⁸ છતાં નિરાશ થયા વિના મનસુખભાઈએ આ અંગેના પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને મુંબઈના "હિન્દુરતાન" સાખાફિકમાં 'કાઠિયાવાહન પત્રો' નામથી દેખમાળા લખવાનું શર કર્યું.⁹

* સૌરાષ્ટ્ર-કુચ્છ ધર્મકાસ પરિષદના ૧૦ મા વિસનગર અધિવેશન પ્રસંગે યોજાયેલી નિખાંધ-સ્પર્ધામાં સ્વામી સંપૂર્ણાંદું ચંદ્રક-વિજેતા નિખાંધ

પછીથી તો એન્નો રાજકોટ આવાને વરસા અને ૧૯૧૮માં સ્થપાવેલી “કાઠિયાવાડ હિત-વર્ષાઈ સભા”ની પ્રવૃત્તિમાં રસ લેવાનું શરીર કર્યું. એમણે ફરી એક વાર ગાંધીજીને કાઠિયાવાડના પ્રશ્નોમાં રસ લેવાની વિનંતી-પત્ર લખ્યો. તારે ગાંધીજીએ જ્ઞાનામાં જાળવેલું કે “હું કાઠિયાવાડના પ્રશ્નોને હળવો ગણ્યો નથી. મારે મન એ એટલો બધો મોટો છે કે આજના સંલેખામાં એ મારી શક્તિ બહારનો છે.....પુષ્ટ વિચાર કર્યા પણ મેં એને પહોં મૂકવાનું વિચાર્યું” છે.....હું પ્રથમ એ માટે બળ મેળવવા માયું હું. એની બેટ તમે આપી શકો નહિ. ભીતરમાં અજિન જોઈએ, પણ એનો આખાવ છે.”¹⁰

એમ છતો નિરાશ થયા વિના મનસુખલાઈએ કાઠિયાવાડની પ્રજાના પ્રશ્નોને વાચ્યા આપવાના પોતાના પ્રયત્નો યાદું રાખ્યા. એ કાર્યમાં એમને લોંખીના શ્રી અમૃતલાલ શેઠ, જોંડાના શ્રી ચંદ્રવાલ પટેલ, વઠવાણના શ્રી કલયંદલાઈ શાં અને જેતપુરના શ્રી દેવયંદલાઈ પારેખ નેવા રંગવરિયા તથા નિષાધાવાન કાર્યકરોનો ટેકો મળ્યો અને એ બધાએ મળા ૫ ડિસેમ્બર, ૧૯૨૦ ના દિવસે રાજકોટમાં ‘કાઠિયાવાડ રાજકોય પરિષહ’ ની સ્થાપના કરી.¹¹ આમ, સૌરાષ્ટ્રના સમસ્ત જીવનને સ્પર્શર્તા પ્રશ્નો ઉકેલવાની આ સંસ્થાની સ્થાપનાને સૌરાષ્ટ્રમાં પ્રજાકીય યણવળના છાતાઢાસમાં એક સીમાન્ધિરું ગણ્યાવી શક્યા.

આ સમેત કિંદમાં અસહકારની યણવળ ચાલી રહી હતી અને રાણ્યિય યણવળને પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ કરનાર પિંડિયા સત્તાની નારાજગીનો બોંગ અને એવી રિથતિ હતી ત્યારે ભીજન વર્ષના નાનકડા એવા રાજકોટ રાજ્યના વિદ્યાર્થીની રાણ્યિય વિચારસરસ્થી ધરાવતા, અગતિશીલ વિચાર ધરાવતા ઢાકોરસાહેબ લાભાજીને ‘કાઠિયાવાડ રાજકોય પરિષહ’નું પ્રથમ અધિવેશ રાજકોટના ભરસા દેવાની પરવાનગી આપત્તાનું નાણું કે સૌરાષ્ટ્રમાં નુતન રાજકોય જીવનની સેનેરી ઉપા પ્રગતી અને સૈકાળુની તંડા તજને તોતીંગ સૌરાષ્ટ્ર આગાં મરડી પેઢા થયાનો નિધાર કરો.¹² આમ, આ પરિષહે સૌરાષ્ટ્રના બધિયાર વાતાવરણમાં નવી હુંવા પેઢા કરી,¹³ આમ કાઠિયાવાડમાં પ્રજાક્ષય અસ્મિતાનો ઉદ્ઘય થયો.

આ પરિષહની પ્રથમ સભા ૫ ડિસેમ્બર, ૧૯૨૦ ના રોજ રાજકોટમાં શ્રી કલયાણરાય નેહાલાઈ અભીના પ્રમુખસ્થાને મળી હતી. આ સભામાં આ પરિષહના હેતુઓની નક્કી કરવામાં આવ્યા હતા તે આ પ્રમાણે હતા :

પરિષહના હેતુઓ :

૧. રાજ્યકર્તાઓની પોતાનાં કર્તવ્યોનું પાલન કરે એવો પ્રયાસ કરવેલા.
૨. દેશી રાજ્યોનો રચનાત્મક વિકાસ કરવેલા.
૩. રાજ્યોની પ્રભાગીની પોતપોતાનાં રાજ્યોની તથા અભિલ હિંદુ પ્રથે રવદેશાલિમાન ધીક્ષિપું.
૪. દેશી રાજ્યોની પ્રભાગીની એકત્રા કાવણી.
૫. એ રાજ્યોનાં બંધારણું તથા વહીવટમાં પ્રલિંગના વિકાસમાં વિદ્વિષ આભિતોને સંગઠિત થઈને દૂર કરવી.

‘કાઠિયાવાડ રાજકોય પરિષહ’ પોતાની અભગીરી અંગે કેટલીક ભર્યાણે મૂકેલી. આપણું સ્કાસન હેઠળ જીવની પ્રજાને જાગત કરીને આરંભે એમનામાં ઉત્સાહ પ્રગતાવવા માટે આપી મધ્યાણી જરરી હતી. વળા, પ્રભાગીની જગૃતિનો સંસાર થાય એ માટે રાજ્ય અને પ્રજા માટે સહકાર જરરી હતો. આમ, આ સંસાર ધીમી ગતિએ, પણ ચોક્સ હેતુથી આગળ વધવા માગતી હતી.¹⁴

કાઠિયાવાડ રાજકીય પરિષદ્ધની કામગીરી :

પરિષદ્ધનું પ્રથમ અધિવેશન (૧૯૮૨, રાજકોટ) : ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ્ધનું પ્રથમ અધિવેશન ૨૭ થી ૩૦ માર્ચ ૧૯૮૨ દરમાન રાજકોટમાં એ સમયના રાજ્યાંત્રી નેતા વિહૃતલાઈ પદેલના પ્રમુખપદે થયું હતું. પરિષદ્ધના સ્વાગત-અંદ્રપ ઉપર “સિદ્ધ બૂર્જ સૌરાષ્ટ્રનો જથું” નો મુદ્રાલેખ આંકિત કરવામાં આવ્યો હતો. એમાં ૮ હન્દર લોકો હાજર રહ્યા હતા. પ્રણતા પ્રશ્નોની ર્ચાની કરવા માટે આવઢી મોટી સંઘામાં હાજરીને સૌરાષ્ટ્રના રાજકોરણ માટે એક વિરલ પ્રસંગ ગણની શક્ય. સી પ્રથમ લાલો કે સૌરાષ્ટ્રમાં પ્રણતીય અસ્તિત્વનો ઉદ્ઘાટન.

પ્રમુખસ્થાનેથી વિહૃતલાઈ પરેલે પ્રેરક સંદેશો આયો. અને બંધારણની ર્માંડામાં રહીને પણ પોતાની માંગણીએ કઠ રોતે રજૂ કરી શક્ય એનો થયમ પાડ એમણે પ્રણતે શીખયો. પ્રણતે છૈયાધારણ મળે તેવું પ્રેરણસભર પ્રવચન એમણે આપ્યું. કાઠિયાવાડના સમર્સત જીવનને સર્પણતા ૩૦ જેટાં કરવો પણ આ પરિષદમાં થયા. આ પરિષદની સાથે જ આચાર્ય કૃપલાશીળના પ્રમુખપદે ‘સૌરાષ્ટ્ર વિદ્યાર્થી’ પરિષદ પણ રાજકોટમાં બારાઈ હતી અને એમની તેજલી જુબાને વિદ્યાર્થીઓમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો. આ પ્રસંગે સૌરાષ્ટ્રના હન્દર ઉંગાળ અને કલાકોરીથનું એક પ્રફર્ણનું પણ ચોન્યું હતું તથા આ પ્રફર્ણનું રાજકોટના ડોકોરસાહેબ લાભાજીને આપ્યો અને આ પ્રફર્ણને પ્રોત્સાહન આપ્યું હતું. આમ, આ પરિષદની શુભ શરદીના તથા શુદ્ધ પુરાણા તથા શુદ્ધામીની વેર નિદામાં પોઢેલી પ્રણ નાયત થઈ.^{૧૪}

પરિષદ્ધનું અધિવેશન (૧૯૮૨, વઠવાણુ) : ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ્ધનું’ પ્રથમ અધિવેશન ધ્યાં કરતો ખૂબ સફળ રહ્યું એવું એક મહાત્મત્વનું કારણ રાજકોટના રાજની લાભાજી-રાજના સાથ-સહકારને ગણની શક્ય. ઉપરાંત મનસુષ્પત્રાઈ મહેતા, અમૃતલાલ શેઠ, દેવચંદ્ર પારેને અને કુલયંહાઈ શાહે એને સફળ અનાવવા ખૂબ મહેનત લીધી હતી. એવામાં સરવાર શિકાર પ્રણે રાજકોટમાં સત્યાગ્રહ થયો હતો, એમાં એક હન્દર લોકોએ હાજરી આપી હતી. મહુલાઈ મહેતા, મણિલાઈ ડેકારી વગેરેની પરસ્પર થતાં પ્રણતામાં એના સામે ઉગ વિરોધ થયો હતો. પરિસ્થિતિ પારખીને રાજ્યે એમને છોડી મુક્યા અને પ્રણતનો વિજય થયો.^{૧૫} સરવાર શિકાર પ્રણે બિટિશ એજન્સીને કે તુમાઝી દાખેલો અને દરાવાર ગોપાળાદસ જેવા દેશભક્તની દસ અને સાયસંકણની જાગીર નજીત કરી લીધેલી તેથી સૌરાષ્ટ્રની પ્રણ બિઠા જિલી હતી, તેથી બિટિશ સત્તા સામે પડકાર દેક્કવા બિટિશ દહ્માં આવેલ વઠવાણું કેરપમાં ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ્ધનું બીજું’ અધિવેશન ૧૧ થી ૧૩ નવેમ્બર ૧૯૮૨ ના તિવસેમાં ગાંધીજીના સાથી અને દેશભક્તન અભ્યાસ તૈયારણના પ્રમુખપદે કરવામાં આપ્યું હતું. આ અધિવેશનની મુખ્ય જવાબદારી કુલયંહાઈ શાહે ઉપાડી લીધી હતી. આ પરિષદ્ધમાં પ્રમુખસ્થાનેથી ડેટાકાડ તાતકાલિક પ્રશ્નોની છણાવત કરવામાં આવી હતી અને પ્રમુખે અભ્યાસ લિન્કના લોકશાહીના સિદ્ધાંતોની સમબંધ આપી હતી. કવિ નાનાલાલે આ પ્રસંગે પ્રસંગાયિત સ્વરચિત એક ગોતી ગાયું હતું અને કલિયુગના જીમ ગણ્યાતા પ્રો. રામમૂર્તિએ રાહિદ્ય એકતા ઉપર મનોય પ્રવચન આપ્યું હતું. બિટિશ એજન્સીને પડકાર આપવાના હેતુથી ત્યાગવીર દરાવાર ગોપાળાદસ દેસાધને અભિનંદન અને માનપત્ર આપવા અંગેને દરાવ પસર કરવામાં આવેલો. અધિવેશનમાં કુલ ૪૨ જેટાં કરવો થયા હતા, એમાં ગાંધીજીના

अंसदक्षरसुगनी छाप होती है। अधिवेशनमां जे उम्र भाषणों थया तेनाथी डेटलाइने एवी भी क पशु लागेकी डे ऐजन्सी सत्तावाणा परिषदने विभेदी नाम्यो, पशु एवुं करी शक्ता नहि, आ प्रसंगे संभानपत्रनो ज्वाल आपतां हरभार गोपालगासे छहेतुं के “दाँड़ावाहतुं” मानपत्र ए मारा माटे विश्व प्रसंग छे, धतिहासप्रसिद्ध सौराष्ट्रनी हालनी यथवणनी आधर्क भूमिमां निवास करी प्रजनी सेवा करवाना एवाधारो हुं शीघ्रो.....हुं तमारा मानपत्र करतां तमारी आशिषनी अखिलापा धरावुं हुं.”¹⁷

आ परिषदमां अंगेने भाटे ऐसवानुं अलग स्थान रथावुं हुं एती जष्ठ श्री वल्लभलाल्य पठेकने थतां एओ जिहीने अंगेने पासे नहर्ने एहा, एमली पाणी हरभार श्री गोपालगास साचे एमतुं कुटुंब गयुं, जेने आ दिवामां सारी शक्तात छही शक्ताय.¹⁸ पछाथी आ परिषदमां ज असृष्टयानिवारणो इत्याव पसार थयो होते.

काठियावाड राजकीय परिषदतुं त्रीजुं अधिवेशन (१६२५, भावनगर) : ‘काठियावाड राजकीय परिषदतुं त्रीजुं’ अधिवेशन भावनगरमां १६२४ मां भरवानो निर्णय थयो होता, परंतु भावनगर राजन्यना आण राजवीनी गाही लेखमां मुकाशे एवो भय हेठा हीवान भलाशांकर पढ़शीजे आ अधिवेशन भावनगरमां करवा सामे १६-४-१६२४ ना दिवसे मनाई-हुक्म भाडार पाह्यो.¹⁹ श्री वल्लभलाल्य पठेल अने श्री अमृतलाल शेठ आ अधिवेशन भावनगरमां करवाना आग्रही होता. भावनगरना हीवाने ए भावनगरनो अद्दे सोनगढां भरवावुं सूचेवेलुं. आम, अधिवेशनतुं स्थान सोनगढां राजतुं के भावनगरमां ए अंगे राज अने प्रज वय्ये उम्र महेन्द्र होता, परंतु अंते गांधीजी अने सर भलाशांकर पढ़शीजी व्यवहारसंज्ञी भिनवहरी संधर्म टल्यो अने सुमेणजर्या वाता-वरशामां ए ८-८ जन्मुकारी, १६२५ मां भावनगरमां योनयुं.

आ अधिवेशनमां १५ फलर भाष्यो निराते एसी शडे एवो आहीनो सलामंडे जिओ करायो होता. आ अधिवेशनना प्रभुभ गांधीजीनी धर्मात्मसार सरवस जेवा कार्यक्रम २८ क्राया होता. आ अधिवेशननो भावनगरना सनातनीज्ञाने उम्र विशेष कर्त्तो होतो अने सलामंडपां हरिकनोने जुदा ऐसवानो व्यवरथा कराई होती, पशु गांधीजीना भाषणनी शेवी असर थर्त होती के नगरशेठ सहित घीन अनेक महातुकावोजे अस्पृश्येनी वय्ये ऐक लाधी. आ अधिवेशननो प्रारंभ कवि लवितज्ञना “अमे तो काठियावाडी, सरल सौराष्ट्रवासी” जेवा गीतथी थयो होता,²⁰ तो भहेन रेहाना तैयालज्ञतुं भजन पशु गवावुं हुं, जेमां “दिन्दु और मुखिम के दिवसे दूर हो, भू-गमेका” गवावुं हुं.²¹ आ परिषदमां भलाशांकर पढ़शीजे कांतवानो लीविली ग्रतिगाने गांधीजीने परिषदतुं भजान कार्य गणावुं हुं.²² आ परिषदना प्रभुभस्यानेथी गांधीजीने काठियावाडना राज्यकर्तान्या द्वारा विदेशप्रवास पाण्य थाता एकाम अर्या, एमना द्वारा चाकात्य संस्कृतितुं थतुं अंगयुं अनुभव, एमनो महेन्द्र उद्धरवानी निर्द्य पद्धति, अनीतिमय आनंदारी कर वयेरे मुद्दांज्ञानो दीक्षा करी होती. अधिवेशनमां परिषदना स्थापक स्व. मनसुभलाई महेताने तथा ग्रसिद्ध कवि कांतने शोकांनवि आपवामां आदी होती.

‘काठियावाड राजकीय परिषदतुं त्रीजुं’ अधिवेशन अनेक रीते अनेक अने महावतुं हुं. आ अधिवेशनना प्रभुभ गांधीजी होता. एओ भाडासलाना पशु प्रभुभ होता तेथी ‘काठियावाड राजकीय परिषदै, प्रादेशिकना अहो राष्ट्रिय स्वदृप्य धारण कुं हुं’. आ परिषद राजकोटना ठाकोर.

साहेब लाभाक्षराजने मानपत्र आपीने द्वाखडो ऐसाएँ के प्रबल योतानां कार्योने ग्रेत्साहन आपनारा राजम्भोने भिरकावी पशु शके छे. मानपत्रनो जवाब आपतां लाभाक्षराजे कहेलूं के “मेरी मारी प्रजना हितमां जे कार्यो कर्मा तेने माटे मारी प्रजन तो मने मान आपे, पशु अनी कह सभय काडियावाली प्रजनमां थाय अने सभाना प्रमुखसाहेय पूज्य महात्माज्ञने हाथे थाय ए मारा मानतनी परिपूर्णता समजुँ हुँ”^{२५} आवा सुंदर जवाब आपीने अमर्लू समस्त काडियावाली प्रजना मन शति वीथां, उपरांत गांधीजीये राजम्भोना अंगत ज्वनना के व्यक्तिगत राजम्भना प्रक्षो वर्चर्वाने अहो समस्त काडियावाले रपर्षता सामान्य अक्षोनी विचारणा हरवा उपर आर भूडो होतो. आदीप्रयार अने अस्पृश्यतनिवारण लेवी रचनात्मक प्रवृत्तिने ग्रेत्साहन आपवा उपर आर भूडवामां आयो होतो.

आवनगरना दीवान प्रक्षाशंकर पटेलुअे प्रबल वती गांधीजीने मानपत्र आपी यरणुरप्पस्त अर्थो त्यारे ए दृश्य अद्विर्भाव-राजपिणी नमूनो होय अेवुं लागतुँ हुँ. गांधीजीये आ प्रसंगे नागपुर सत्याग्रहमां जर्द आपेला सत्याग्रहीजोने सुवर्णार्थांडको आपीने ‘चांद शोकावले’ अेवी शिखामण्य आपी हती, उपरांत गरीजोने रेटियो कांतवानो अने सवबोने आक्षण्ठेटी हुर रहेवानो भाष आपो होतो.

आ अधिवेशनने संपूर्णपछि ‘गांधी-अधिवेशन’ कही शकाय, कारण के अधिवेशनना ए दिवसो दरभ्यान गांधीजीतुँ सभय व्यक्तिगत हरेक वापत उपर छाई गयुँ हुँ”^{२६}

काडियावाड राजकीय परिषद्हतुँ चायुँ अधिवेशन (१९८८, पौरष्ठांहरः): आ परिषद्हतुँ चायुँ अधिवेशन ठक्करायापाना प्रमुखपदे पौरष्ठांहरमां २० थी २२ जन्युआरी, १९८८ना दिवसोमां भरायुँ हुँ. आवनगर-अधिवेशन पछी नये वर्षे आ अधिवेशन थयुँ ए गांधीजीनी नातिने आबारी हुँ, कारण के उद्घाम विचारणां कार्यकर्तेने सौराष्ट्रतुँ कोर्ट पशु राज्य परिषद भरवानी कृष्ट आपत्तुँ न हुँ. आ परिषद्मां प्रमुखपदेटी ठक्करायापाने नागरिकस्वतंत्रा उपरांत नियंत्रणे हुर करवा, डेप्रेशन नाश्वर करवा, रेलवेन-तंत्रमां सुधारो करवा, अस्पृश्यतनिवारण करवा, कन्याविक्षय अने भव्यानिवेद अंगे कार्य करवा स्यननो ईर्यां हतां. उपरांत आ अधिवेशनमां काडियावालमां व्यायामप्रयार करवाने लगतो, आदीप्रयार करवा अने अेवुं वेचालू वधारवाने लगतो, देखी राजम्भोमां प्रबलप्रतिनिविसकानी स्थापनानो तथा राजनेना अंगत भर्य धराउवा अंगे हरावे यपा होता. परिषद्हतुँ भव्यानिवेद जेतां गांधीजीये कहुँ हुँ के “आ परिषद भरकर्तानी छे, सिंहनी नथी.”^{२७} आ परिषद्मां ज संपूर्ण काडियावाड माटे पालुनो संग्रह, वृक्षोनो संग्रह रेम तुहि, समान जकात अने समान वहीवट वगोरे वापतो विशे पशु वर्चर्यां थर्ट होती. लग्ना, आ कार्यो माटे अने प्रबलमां लग्नति लाववा माटे हरेक राज्यमां पोतानी परिषदो होती जडी छे अमे ठरावायुँ हुँ. प्रबल अने राजना संघर्ष द्वर्षयतां गांधीजीये कहुँ के “प्रबल मूल छे तो राज्य कृष्ण छे, भूमि भीहुँ होय तो कृष्ण भीहुँ ज पाइवातुँ.”^{२८} उपरांत आ परिषद्मां अधिवेशनो जुही जुही जग्याए ठरवातुँ नझी थयुँ हुँ.

काडियावाड राजकीय परिषद्हतुँ पांचमुँ अधिवेशन (१९८८, मोरणी): ‘काडियावाड राजकीय परिषद्हतुँ पांचमुँ अधिवेशन ३०-३१ मार्च अने १ अप्रिल, १९८८ना दिवसोमां मोरणी सुकामे सदरार पव्ववलासाई पटेलना प्रमुखपदा नीचे थयुँ हुँ’. आ परिषद्मां पशु गांधीजीये प्रविक्षिक]

ହାଜରୀ ଆପି ହତା. ଆ ସମୟେ ଜ କାହିଁଯାବାଢ଼ନା ଜୁଵାନୋରେ ମୋରଭୀମାଂ ଯୁଵକ ପରିଷଦ ଭରଚାନ୍ତୁ ନକ୍ଷୀ କୁଣ୍ଡ ହତୁ, ପରିଷ ମୋରଭୀନା ଠାକୋର ଯୁଵକ ପରିଷଦ ତ୍ୟା ଭରାସ ଏ ମାଟେ ତୈସାର ନ ହତା. ଗାଂଧୀଙ୍କ ପଣ୍ଡ ଏ ଅଜେ ଯୁଵକୋନେ ସମଜଲୀନୀ ଶକ୍ତା ନାହିଁ ତେଥି ଶ୍ରୀ ଅଭ୍ୟତଳାବ ଶୈଠ, ରାମନାରାୟଣ ପାଠକ, କଳକ ଡୋଡାରୀ ନେବା ପରିଷଦନ ଜୁଵାନ ଆଜେବାନୋରେ ମୋରଭୀମାଂ ଏ ପରିଷଦ ଭରଚାନ୍ତୁ ଗାଂଧୀ ବାଜୁଣ୍ଡ, କେ ପାଂୟ ଭଦିନା ପଛି ରାଜକୋଟମାଂ ଜ୍ଵାଲାରାବାଲ ନହେନୁ ପ୍ରମୁଖପଦେ ଭଣୀ ହତା, ଜ୍ୟାରେ ‘ଯୁଵକ ପରିଷଦ’ନା ବରାୟେବା ପ୍ରମୁଖ ଭଜିଦାଳ ଡୋଡାରୀ ଅନେ ମୋରଭୀନା ମହାରାଜା ପଣ୍ଡ ପରିଷଦମାଂ ହାଜର ରଖା ହତା. ପରିଷଦନା ପ୍ରମୁଖ ଚରଦାର ବରଳଭାବାର୍ଥ ପଟେଳେ ନେବା ପରିଷଦନ ଯୁଵକୋନେ କରେଲ ଅଫିକ୍ଷାରଥୀ ହୁଏୟ ଥିଲୁ’ ହତୁ. ଏମଣ୍ଣେ ଯୁଵକୋନେ ଓାଜୁଣ୍ଡ ଯୋବାନ୍ତୁ ଅନେ ବୁଝ କାମ କରଚାନ୍ତୁ କୁଣ୍ଡ ହତୁ.^{୧୩} ଏମଣ୍ଣେ ରାଜ ଅନେ ପ୍ରଜ ପାନେ ପୋତପୋତନେ ଧର୍ମ ଅତାବି ଏ ପୂରୀ କରଚା ଅନୁରୋଧ କର୍ଯ୍ୟ ହତେ. ଏମଣ୍ଣେ କର୍ତ୍ତବ୍ୟ କୁଣ୍ଡରୁ କେ କାହିଁଯାବାଢ଼ନା ପ୍ରଜନେ ପ୍ରାଣାଜିନ ଓାକାବାର୍ଥ ଗ୍ୟୋ ଛେ. ଏନା କୁଣ୍ଡରେ ହୈୟାମାଂ ଚିନଗାରୀ ଅଣାଟାପବାନୀ ଜର୍ଦର ଛେ, ୨୯ ତେଥି ଆଜନୀ ପରିଷିତିମାଂ ପରିଷଦନ୍ତୁ ମୁଖ୍ୟ ଧର୍ମ ପ୍ରଜମାଂ ପ୍ରାଣ ରେତବାନ୍ତୁ ହେବୁ’ ଲେଖାଯେ. ଉପରାଂ ଏମଣ୍ଣେ ଏମ ପଣ୍ଡ କରୁ କେ “ନନ୍ଦ ଵର୍ଷମାଂ ପରିଷଦନା ପାଂୟ ଅଧିବେଶନ ଥିଲା ଏ ପରିଷଦନୀ ଧ୍ୟାନାହୋ ଡେଲା ଛେ ଏଥାପି ଛେ.....ରାଜ ପାସେ ପରିଷଦନୀ ପ୍ରତିଷ୍ଠା ନଥି.....ରାଜନେ ପାସେ କାମ କରଚାନ୍ତୁ ହୈୟ ତେ ପରିଷଦନୋ ରାଜନେ ପ୍ରତ୍ୟେ ପ୍ରେମ ଲୋଇଛ ଅଥବା ପରିଷଦମାଂ ରାଜନେ ପଦବ୍ରତ କରଚାନୀ ଶତି ଲେଇଗେ.”^{୧୪} ଆମ ପ୍ରମୁଖପଦ୍ଧତି ଚରଦାର ପଟେଳେ ସୌରାଷ୍ଟ୍ରନୀ ପ୍ରଜନେ ବଣାନୀ ଶତି ଅକ୍ଷତ କରଚାନେ ଏଥ ଆପେ. ଗାଂଧୀଜି ଦୂର ଏକ ବାର ରିତ୍ୟେ ଆହା ଅନେ ରଯନାତମକ କର୍ଯ୍ୟ ଉପର ଲାର ମୂଳ୍ୟ, ଆ ପରିଷଦନ ଅତେ ଅନେକ ଜୁଵାନେ ଆହା ପହେଲା ଲାଗ୍ୟା ହତା ଅନେ ସେବାକାର୍ୟମାଂ ଲୋହାଯା ହତା.

କାହିଁଯାବାଢ଼ ରାଜକୀୟ ପାନ୍ଧେବନ୍ତୁ ଛବୁ’ ଅଧିକବେଶନ (୧୯୩୭, ରାଜକୋଟ) : ‘କାହିଁଯାବାଢ଼ ରାଜକୀୟ ପରିଷଦନ୍ତୁ ଛବୁ’ ଅଧିବେଶନ ୬ ଥି ୮ ନଵେମ୍ବର, ୧୯୩୭ ନା ହିନ୍ଦ୍ସୀମାଂ ଲୋହାଯା ଏହିଙ୍ଗମାଂ ୮ ଵର୍ଷ ପାଇଁ ହରଭାର ଜୋପାଣାଦାସନା ପ୍ରମୁଖପଦେ ଭରାଯୁ’ ହତୁ. ସ୍ଵାଗତପ୍ରମୁଖ ତରିକେ ଉ. ନ. ଡେବର ହତା. ହରଭାର ଜୋପାଣାଦାସ ଅନେ ଡେବରଭାବାନ୍ତୁ ଆ ମିଳନ ଛେବଟ କୁଣ୍ଡ ରହୁ’ ତଥା ଆ ଲୋହି କାହିଁଯାବାଢ଼ ନାହେନ କୁଣ୍ଡନେ ବଣ ପ୍ରୁଦୁ’ ପାଇୟୁ. ଚରଦାର ପଟେଳେ ପଣ୍ଡ ଆ ପରିଷଦମାଂ ହାଜର ରଖା ହତା. ସ୍ଵାଗତପ୍ରମୁଖ ତରିକେ ଡେବରଭାବାନ୍ତେ ଛାଇବାରେ ଅନେ ଆଂକଣାମୋରୀ ଯୋଇଦାଇ ଅନେ ତର୍କାରକ ଦଳିଲୋଥି ନାହିଁ କେ ରାଜନୀରୀ ବିଦୁତନୋ ଡେବାରୀ ଅଧିକବେଶନମାଂ ମଧ୍ୟକ୍ଷର ତିରେହ ନେବା ସୌରାଷ୍ଟ୍ରନୀ ମହାରଥୀଜ୍ଞା ଅନେ ପରିଷଦନ ଏ ମାଝ ପ୍ରମୁଖେ ବିକ୍ଷଳାଇ ପଟେଳ, ଅଭ୍ୟାସ ତୈୟାଗ୍ରହ ତଥା ଅଭ୍ୟାସ ତୈୟାଗ୍ରହ ତଥା ଅଭ୍ୟାସରୀନା ଆଜେବାନ ହରିବାଲ ପାରେନା ଅଧିବେଶନ ଭବତ ଶୈଠ ପରିଷଦ ଭରତା ହଶାନ ପ୍ରକାର ହାଜାର ହତା.

ପରିଷଦନ ପ୍ରମୁଖ ଜୋପାଣାଦାସ ଦେବାଧିନ୍ୟ ଅଧିକ ପରିଷଦ ରଯନାତମକ କାର୍ଯ୍ୟକ୍ରମ ଅପନାପବା ଜ୍ଵାଲାନ୍ତୁ’ ହତୁ. ଏମଣ୍ଣେ ଏମ କରୁ କେ ଆହା, ଅସ୍ଵାକ୍ସତାନିଵାରଣ, ଆମୋଦୋଗ ଅନେ ଦାତାବୀନୀ ଯଥୁର୍ବିଧ କାର୍ଯ୍ୟକ୍ରମ ପାଇ ପାଇବାମାଂ ଆବେ ତେ ନିଷିଦ୍ଧ ସେଇ ମେଣ୍ଟି ଶକ୍ତାପ. ଦାତାବୀନ୍ତୁ’ କାର୍ଯ୍ୟ ସୌରାଷ୍ଟ୍ରନୀ ଖୀଅନେ ଉପାରୀ ଲେବାନୀ ଏମଣ୍ଣେ ବିନାଂତି କରି, ତେ ଜ୍ଵାଲାର ରାଜ୍ୟନାନ୍ତରେ ମାର୍ଗଶୀଳ ଅବ୍ୟାସପୂର୍ଣ୍ଣ ବିଗନ୍ତେ ରଜ୍ନ୍ କରି ହତା. ଚରଦାର ପଟେଳେ ଆଭିଜ୍ଞାନ କରତାଂ କର୍ତ୍ତବ୍ୟ କେ “ଆହ ଵର୍ଷନା ଲାଞ୍ଚା ସମୟ ପାଇଁ ଆ ଅଧିବେଶନ ଥାଇ ରହୁ” ଏ ମାଟେ ନଵ୍ୟାଧାର ଡୋଡା ? ଏ ମାଟେ ରାଜନେ କରତାଂ ଆପଣେ ପେତେ ପଥାରେ ଜ୍ଵାଲାଧାର ଧିନ୍. କାଂତି କରନୀ, ସତ୍ୟାଗ୍ରହ କରିବେ ବାବେ ତେ ଲେ ଲାଞ୍ଚା ସଂକଳଣୀ, ପଣ୍ଡ ଅଧିକା କରନାର ମୋଟରୀ ଯୋକାତା ନଥି. ସବିନ୍ୟ ଲାଙ୍ଗନୀ ବାବେ ଥାଏ ଛେ, ପଣ୍ଡ ବାତାଵରଣ୍ଡ ତେ ଅବିନ୍ୟତୁ’ ଛେ ଏଟିକେ ଅବିନ୍ୟ ନ ଜ୍ୟ ତ୍ୟାକୁଥି ସବିନ୍ୟ ସତ୍ୟାଗ୍ରହ ନ ଥାଇ ଥିଲେ.^{୧୫} ମନୁକାର୍ଥ ପ୍ରୋତ୍ସହ ମୁହେଲୋ ପାଶୀସ୍ଵାତନ୍ତ୍ୟ, ଲେଖନସ୍ଵାତନ୍ତ୍ୟ ଅନେ ସଂଧା-

[ଅନୁସଂଧାନ ପା. ୫ ମେ]

ଅଭିଜ୍ଞ/୧୯୬୩

[୫୩୫]

હનુમાનજીની મૂર્તિએં : વીરપુર



[ચિત્ર ૩ : પા. ૧૪]



[ચિત્ર ૪ : પા. ૧૫]

મુદ્રણ પ્રકાશક અને તત્ત્વી : 'પથિક કાર્યાલય' માટે પ્રો., ડૉ. કેશવરામ કા. શાસ્ત્રી, ડૉ. ભાગુવન, એલિસાભિલ,
અમદાવાદ-૩૮૦૦૦૬

તા. ૧૪-૪-૧૯૬૩

મુશ્કૃતસ્વભાન : પ્રેરણ મુશ્કૃતસ્વભાન, તુસ્તમાલાનો ટાળ, મિરાલપુર, અમદાવાદ-૩૮૦૦૦૧

પૃષ્ઠ : ઇન્ટરનેશનલ પ્રિન્ટિંગ વૈસ, શાહપુર, માળાવાડાની પોણ સારે, અમદાવાદ-૩૮૦૦૦૧